https://archive.org/details/bk1391/page/n0/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

All Items on https://archive.org/details/realpatidar

ઓકટોબર ૨૦૦૮ થી દર મહિનાની ૧૫ મી તારીખે પ્રકાશીત થતું
કચ્છ કડવા પાટીદાર સમાજનુ નીડર અને લોક પ્રીય માસીક સમાચાર પત્ર
તારીખ : ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪
છૂટક કિંમત : રૂા. ૧૭/-

Full Library on https://realpatidar.com/library

પાટીદાર બંધુ

સમાજનું સાચુ પ્રતિબિંબ

તંત્રી : બ્રિજેશ પટેલ

વર્ષ : ૪ અંક : ૯

ખરેખર આને કહેવાય 'સી. એમ. (કોમન મેન)' !!!

મપુસા (ગોવા) ના
કચ્છ કડવા પાટીદાર સમાજ
અને યુવક મંડળને સંબોધી રહેલ
ગોવાના મુખ્ય મંત્રી
શ્રી મનોહર પારિકર

આજકાલ રાજકરણમાં આમ આદમી પાર્ટીની સાદગીની વાતો ખુબ થઈ રહી છે પણ ગોવાના મુખ્ય મંત્રી મનોહર પરિકર કોઈપણ જાતનો ઢંઢેરો પીટયા વગર ખરેખર આમ આદમીની જેમ જીવન વિતાવે છે અને રાજયની સેવા કરે છે. તાજેતરમાં ગોવાના મપુસામાં કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ મપુસા દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પરિકર પધાર્યા હતા અને કાર્યકર્તાઓનો ઉત્શાહ વધાર્યો હતો. તેમની સાદગી એ સૌને પ્રભાવિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મનોહર પરિકર રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સ્વયં સેવક હતા. સંઘના સંસ્કારો તેમના વ્યકિતત્વ માં ડગલે ને પગલે છલકે છે. ભારત માતા ને સંસદમાં આવા ૩૦૦ નેતાઓની જરૂર છે.
લાગી જાવ મિશન રાજકીય ૨૦૧૪ માં...

નરોડાના અગ્રણી દામુભાઇ ગોગારીનું દુ:ખદ નિધન.

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1391/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:47:29 +05'30'

ઓકટોબર ૨૦૦૮ થી દર મહિનાની ૧૫ મી તારીખે પ્રકાશીત થતું
કચ્છ કડવા પાટીદાર સમાજનુ નીડર અને લોક પ્રીય માસીક સમાચાર પત્ર

તારીખ : ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪
છૂટક કિંમત : રૂા. ૧૭/-

realpatidar.com

પાટીદાર બંધુ

સમાજનું સાચુ પ્રતિબિંબ

તંત્રી : બ્રિજેશ પટેલ

વર્ષ : ૪ અંક : ૯

ખરેખર આને કહેવાય 'સી. એમ. (કોમન મેન)' !!!

મપુસા (ગોવા) ના કચ્છ કડવા પાટીદાર સમાજ અને યુવક મંડળને સંબોધી રહેલ ગોવાના મુખ્ય મંત્રી શ્રી મનોહર પારિકર

આજકાલ રાજકરણમાં આમ આદમી પાર્ટીની સાદગીની વાતો ખુબ થઈ રહી છે પણ ગોવાના મુખ્ય મંત્રી મનોહર પરિકર કોઈપણ જાતનો ઢંઢેરો પીટયા વગર ખરેખર આમ આદમીની જેમ જીવન વિતાવે છે અને રાજ્યની સેવા કરે છે. તાજેતરમાં ગોવાના મપુસામાં કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ મપુસા દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પરિકર પધાર્યા હતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમની સાદગી એ સૌને પ્રભાવિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મનોહર પરિકર રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સ્વયં સેવક હતા. સંઘના સંસ્કારો તેમના વ્યકિતત્વ માં ડગલે ને પગલે છલકે છે. ભારત માતા ને સંસદમાં આવા ૩૦૦ નેતાઓની જરૂર છે.
લાગી જાવ મિશન રાજકીય ૨૦૧૪ માં...

નરોડાના અગ્રણી દામુભાઈ ગોગારીનું દુઃખદ નિધન.

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n3/mode/1up

https://archive.org/details/bk1391/page/n4/mode/1up

realpatidar.com

વર્ષ -૪ અંક : ૯
પેજ - ૪૦ (ટાઇટલ સાથે)
તા. ૧૫ ફેબ્રુઆરી - ૨૦૧૪

પાટીદાર બંધુ

માસિક સમાચાર પત્ર

:: તંત્રી ::
બ્રિજેશકુમાર સી. પટેલ

:: સહતંત્રી ::
વિરેન્દ્રભાઇ હળપાણી
જીગ્ના પટેલ

: મુદ્રક, પ્રકાશક અને માલિક :
બ્રિજેશકુમાર સી. પટેલ

:: ચીફ બ્યુરો ::
જગદીશ હળપાણી-ચેન્નાઇ
મો. ૯૪૪૪૪૪૪૮૩૯
સત્યેન લીંબાણી-પુના
મો. ૦૯૫૭૯૧ ૫૧૫૧૬

: કાર્યાલય તથા પ્રકાશન સ્થળ :
'પાટીદાર બંધુ'
C/o. શ્રી ગણપતિ સો મીલ
વેરાઇ ચકલા,
પાટણ. (ગુજરાત) ૩૮૪૨૬૫

:: મુદ્રણ સ્થળ ::
વિનોદ પ્રિન્ટરી, પાટણ.

: સંપર્ક સેતુ :
બ્રિજેશ પટેલ : મો. ૯૮૯૮૦ ૬૬૮૩૦
વિરેન્દ્ર પટેલ : મો. ૯૮૯૮૫ ૭૫૭૬૭
ઓ. (૦૨૭૬૬) ૨૨૦૫૭૬
E-mail :
patidarbandhu@gmail.com

દ્વિવાર્ષિક રૂા. ૩૦૦/-
ત્રિવાર્ષિક રૂા. ૪૫૦/-

પંચવર્ષિય -૬૦૦
આજીવન - ૧૧૦૦

ગૌરવમ્ પ્રાપ્યતે દાનાત્ નતુ વિતસ્ય સંચયાત ।
સ્થિતિ રૂચ્ચૈ : પયોદાનાં, પયોધિ નામધ : સ્થિતઃ ।।

દાન કરવાથી ગૌરવતા પ્રાપ્ત થાય છે નહીંકે ધન એકઠુ કરવાથી જેવી રીતે પાણી આપનાર વાદળોનું સ્થાન ઉંચુ છે. જ્યારે પાણીનો સંગ્રહ કરનાર સમુદ્રનું સ્થાન નીચું છે.

* * * *

કર્તવ્યમેવ કર્તવ્ય પ્રાણૈ : કંઠ ગતૈરપિ ।
અકર્તવ્યમ્ ન કર્તવ્યમ્ પ્રાણૈ કંઠગતૈરિપ ।।

જે કાર્ય કરવાનું છે. તે કરી નાખવું જોઇએ તે વખતે કંઠમાં રહેલા પ્રાણ ભલે જતા હોય જે કરવા જેવું ન હોય તે કંઠમાં રહેલા પ્રાણ જાય તો પણ ન કરવું જોઇએ.

* * * *

કર્મણ : સુકૃત સ્યાહુ : સાત્વિકમ નિર્મલમ ફલમ્ ।
રજસસ્તુ ફલંદુ:ખમ્ અજ્ઞાનમ્ તમસં : ફલમ ।।

સારા કર્મનું ફળ સાત્વિક નિર્મળ કહેવાય છે. રજો ગુણનું ફળ દુ:ખ દાયક છે તમો ગુણનું ફળ અજ્ઞાન કહેવાય છે.

વાચક જોગ નિવેદન...

અનિવાર્ય સંજોગોને કારણે 'પાટીદાર બંધુ' સમાચાર પત્રનો આગામી માર્ચ અને એપ્રિલનો અંક પ્રકાશિત કરવામાં નહીં આવે. જેની સર્વે નોંધ લેશો. મે મહિનાથી અંક રાબેતા મુજબ પ્રકાશિત થશે. અસુવિધા માટે ક્ષમા કરશો...

લિ. તંત્રી

: જાહેરાત, લવાજમ અને પોસ્ટીંગ વિભાગ :
મહેન્દ્ર ડી. ભાવાણી
૮૧૪૧૭ ૨૭૫૨૦, ૮૮૬૬૫૧૯૪૪૮

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n5/mode/1up

realpatidar.com

તંત્રી સ્થાનેથી...

સમાજ બહુધર્મીય નહીં પણ બિનસાંપ્રાદાયિક હોવો જોઈએ..

કેન્દ્રીય સમાજ દ્વારા બહાર પાડવામાં આવેલ શ્વેતપત્રમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ''અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ શુદ્ધ વૈદીક સનાતન ધર્મ પાળતો સમાજ છે.'' સમાજને આવી સ્પષ્ટતા કરવી પડી તેનું કારણ બધા જ જાણે છે. આ સ્પષ્ટતા પછી સતપંથ ધર્મનો બચાવ કરવાવાળા એવી દલીલો (આજ સુધી) કરી રહ્યા છે કે ''સમાજે બિનસાંપ્રાદાયિક હોવું જોઇએ, ધર્મના ઝગડા સમાજમાં ના ચાલે, આજના સમયમાં ધાર્મિક વિખવાદો આપણા સમાજને શોભતા નથી,'' વગેરે વગેરે સુફીયાણી વાતો કહેવાતા સમાજ હિતેચ્છુઓ કરતા હોય છે. ખાસ કરીને મુંબઇના મંચો ઉપર આવા ભાષણો બહુ થાય છે.

અમારું સ્પષ્ટ કહેવું છે કે ''સમાજ બિનસાંપ્રાદાયીક હોવો જોઇએ. પણ એક કરતા વધુ ધર્મોવાળો બહુધર્મી નહીં. આજકાલ બિનસાંપ્રાદાયિક શબ્દ ખૂબ જ ચર્ચાતો શબ્દ છે. બિનસાંપ્રાદાયિકતા એટલે શું? એ આપણે સમજીએ. બિનસંપ્રાદાયીક શબ્દનો સામાન્ય અર્થ છે 'સંપ્રદાય વગરનો.' ધર્મ વગરનો નહીં. સંપ્રદાય અને ધર્મ અલગ વસ્તુ છે. સંપ્રદાયનો ધર્મ ના હોય પણ ધર્મના સંપ્રદાયો હોય છે. એક જ ધર્મના અલગ અલગ સિધ્ધાંતો અને વિચારધારા વાળા સંપ્રદાયો હોય છે. પણ કોઇ સંપ્રદાયના અલગ અલગ ધર્મો નથી હોતા.

૧૯૪૭માં અંગ્રેજો આ દેશ છોડીને જતા રહ્યા. પણ તેમની ''ભાગલા કરો અને રાજ કરો''ની મનોવૃત્તિ અહીં જ છોડતા ગયા. અંગ્રેજોની કુટનીતીને કારણે આ દેશના ભાગલા થયા. બે દેશો કટ્ટર ઇસ્લામી રાષ્ટ્ર બન્યા. જ્યારે અનાદીકાળથી શુદ્ધ સનાતની વૈદીક પરંપરાવાળો ભારત દેશ સેક્યુલર રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યો. કોઇપણ દેશને અધાર્મિક કહેવો શોભે નહીં એટલે બિનસંપ્રદાયીક દેશ કહેવામાં આવે છે.

સમગ્ર ઇસાઇ જગતનો ડોળો ભારત ઉપર છે. વેટીકનના પોપ ભારતમાં આવીને જાહેરમાં કહી ગયા છે કે ૨૧મી સદીમાં ભારતને ઇસાઇ રાષ્ટ્ર બનાવવામાં આવશે. દેશના સર્વોચ્ચ સ્થાનો ઉપર બેઠેલા એક પાર્ટીના ઘણા બધા નેતાઓ, મંત્રીઓ પોપના મીશનને સાકાર કરવામાં લાગી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ મીશન હેઠળ ભારતના પવિત્ર સાધુ સંતોને હત્યા, બળાત્કાર અને જમીન કૌભાંડના આરોપો હેઠળ ફસાવી દેવાની કુપ્રવૃત્તિ છેલ્લા ૧૦ વર્ષમાં ખૂબ જ ફૂલીફાલી છે. દેશનું સેક્યુલર મીડીયા પણ આ મીશન માટે જ કામ કરતું સ્પષ્ટ દેખાય છે. (વિવેક દષ્ટિથી જોનારને જ દેખાય છે) સંઘ પરિવાર અને સંતો જ હિન્દુ સંસ્કૃતિના રક્ષક છે. માટે આ બંનેને બદનામ કરવામાં આવી રહ્યા છે.

આપણી સમાજની વાત કરીએ તો આપણા સમાજમાં અનેક સંપ્રદાયો પાળતા લોકો છે જ. તેનો કેન્દ્રીય સમાજે કે અન્ય કોઇ સનાતની કાર્યકર્તાઓએ કદી વિરોધ કર્યો નથી અને કરવો પણ ના જોઇએ. જે સનાતની સંપ્રદાયો છે તે બધા જ સ્વીકાર્ય છે.

હવે વાત આવે છે સતપંથની. સતપંથ શું છે? સંતપંથને લોકો ધર્મ કહે છે. આપણે લોકો અજ્ઞાનવશ સતપંથને જુનોધર્મ કહીએ છીએ અને સનાતનને નવો ધર્મ કહીએ છીએ. આ નરી મુર્ખતા છે. દુનિયાનો સૌથી જુનો ધર્મ સનાતન ધર્મ છે. એ દરેકે સમજી લેવાની જરૂર છે. સતપંથ તો ૪૦૦-૫૦૦ વર્ષ જુનો ધર્મ કે ઇસ્લામના નિઝારી પરંપરાનો સંપ્રદાય છે.

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n6/mode/1up

realpatidar.com

તમામે તમામ સરકારી રેકોર્ડ અને ઐતિહાસિક દસ્તાવેજો એમ જ કહે છે કે સતપંથ ઇસ્લામના નિઝારી પંથનો એક સંપ્રદાય છે. ઐતિહાસિક દસ્તાવેજોના આધારે એ વાત સ્પષ્ટ છે કે 'સતપંથ ધર્મ' ઇસ્લામ ધર્મનો એક ભાગ છે. આથી 'સતપંથ' સનાતન ધર્મનો સંપ્રદાય નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે તેમ એક જ્ઞાતી આધારીત સમાજમાં બે ધર્મ ના રહી શકે. અહીં બીજી એક વાત એ સ્પષ્ટ કરી દઇએ કે 'પાટીદાર બંધુ' એમ નથી કહેતું કે ક.ક.પાટીદાર સતપંથીઓ હિન્દુ નથી. ક.ક.પાટીદાર સતપંથીઓનું મૂળ શુદ્ધ સનાતન વૈદીક ધર્મ જ છે. પરંતુ તેઓ પીરાણા પંથમાં હજી સુધી અટવાયેલા છે. શ્રધ્ધા કબરમાં હોય કે અકબરમાં હોય તેનાથી કોઇને કોઇ વાંધો ના હોવો જોઇએ. શ્રધ્ધા સ્વંતત્ર છે પણ આ સ્વતંત્ર શ્રધ્ધાના નામે કોઇ પરાઇ પરંપરામાં પરતંત્ર બની જવું જરા પણ યોગ્ય નથી. ગીતામાં ભગવાને કહ્યું છે ''સ્વધર્મે નિધનમ્ શ્રેયઃ પરધર્મો ભયાવહ'' સતપંથ આપણો સ્વધર્મ નથી પરધર્મ છે. ભલે ગમે તે કારણોસર કે મજબૂરીને લીધે આપણે ભૂતકાળમાં તે અપનાવ્યો પણ વર્તમાનમાં તેને પકડીને ચાલવાની જરૂર ક્યાં છે? શ્રધ્ધા હોય તો અંતરમાં રાખવી જોઇએ. સતપંથના નામે સમાજ બનાવવાની જરૂર ક્યાં છે?

જેને પરાઇ પરંપરાના ગુલામ બનવું જ હોય તો કોઇને કોઇ વાંધો ના હોવો જોઇએ પણ ૧૦-૧૫ ટકા લોકોના કારણે આખા સમાજની જગ હસાઇ પણ ના થવી જોઇએ. પીરાણા જઇ આવેલા અન્ય પાટીદારો કચ્છ કડવા પાટીદારને અજુગતી નજરે આજે પણ જુએ છે. બે મહિના પહેલા મને આનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. પણ શ્વેતપત્ર એ મારા સન્માનની રક્ષા કરી. બે મહિના પહેલા એક કાર્યક્રમમાં મને મોડસીયા કડવા પાટીદાર સમાજની કેટલીક વ્યક્તિઓ મળી. તેમણે મારા સમાજ વિશે પૂછ્યું. મેં કહ્યું હું ''કચ્છ કડવા પાટીદાર છું.'' આટલું સાંભળતા જ તેમાં રહેલા આખા બોલા બહેન બોલ્યા ''અરે તમે એવા ધર્મમાં કેમ માનો છો? અમે પીરાણા ગયા હતા. ત્યાં એક બાજુ મસ્જીદ છે અને એક બાજુ દરગાહ છે ને એકબાજુ મંદિર છે. આવું તો અમે હિન્દુધર્મમાં નથી જોયું. અમને તો નવાઇ લાગે છે કે પાટીદારો આવા ધર્મને માને છે?'' (આમાં કોઇ બનાવટ નથી કરી.)

મેં મોડસીયા કડવા પાટીદાર સમાજની વ્યક્તિને સ્પષ્ટ કહી દીધું કે ''પીરાણા સતપંથને અમારા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સાથે કોઇ લેવા દેવા નથી. બંને સમાજો અલગ છે. હાઁ અમે બધા એક વંશના છીએ પણ સામાજિક દષ્ટીએ અમે તેમનાથી અલગ છીએ.''

આ એકદમ સાચી વાત છે. મને તો એમ થાય છે કે શ્વેતપત્ર બહાર ના પાડ્યું હોત તો હું શું જવાબ આપત. મારે આંખો પટપટાવીને લુલો બચાવ કરવો પડ્યો હોત. પણ શ્વેતપત્રને કારણે મેં આંખમાં આંખ નાંખીને જવાબ આપ્યો. આભાર! શ્વેતપત્ર અને કેન્દ્રીય સમાજને.

આપણે વાત કરતા હતા ધર્મ અને સંપ્રદાયની. હવે તો કદાચ બધાન સમજાઇ ગયું હશે કે સંપ્રદાય અને ધર્મ એટલે શું? સનાતન સમાજમાં લક્ષ્મીનારાયણ વાળા, સ્વામીનારાયણવાળા સ્વાધ્યાયવાળા અને આર્ય સમાજવાળા આ વાળા વાળા વિવાદો ના થાય તે જરૂરી છે. સનાતની વૈદિક પરંપરા અને સિદ્ધાતો પ્રમાણે ચાલતા બધા જ સંપ્રદાયો સનાતનના છે. સંપ્રદાયિક વ્યક્તિએ સંપ્રદાય લઇને સમાજમાં ના આવવું જોઇએ. સંપ્રદાય એ વ્યક્તિગત શ્રધ્ધાનો વિષય છે. સમાજ બિનસંપ્રદાયીક હોવો જોઇએ પણ બહુધર્મીય ના હોવો જોઇએ.

તંત્રી

બ્રિજેશ સી. પટેલ

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n7/mode/1up

realpatidar.com

વાચકનો પત્ર

નરસિંહભાઇ પટેલ-અમદાવાદ.
તા. ૨૪-૧-૨૦૧૪

આ પત્ર લખનાર કેન્દ્રીય સમાજના મંત્રી છે.

પ્રતિ તંત્રીશ્રી, પાટીદાર બંધુ
ભાઇશ્રી બ્રિજેશ.

જય ઉમિયા સાથે જણાવવાનું કે પાટીદાર બંધુ ૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના તંત્રીલેખના અનુસંધાને જણાવવાનું કે આપશ્રીએ તંત્રીલેખ દ્વારા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજમાં વર્તમાન સમયમાં સમાજમાં પ્રવર્તતી ગતિવિધી વિશે પ્રકાશ પાડ્યો છે. આપે લખ્યું છે કે લક્ષ્મીનારાયણ કેન્દ્રના માર્ગદર્શક સંતોના ઉચ્ચારણોથી આગામી સમયમાં કેન્દ્રીય સમાજમાં વધુ ફાંટાઓ પડે તો નવાઇ નહીં. સાથે સાથે આપે આગળ લખ્યું છે કે લક્ષ્મીનારાયણ સંસ્થા પોતે જ પોતાની વિચારધારા સંકુચિત કરી રહી હોય તેવું લાગે છે. જે સામાજિક પ્રેમભાવ અને એકતા માટે જોખમ રૂપ છે.

સંતોના ઉચ્ચારણોથી કેન્દ્રીય સમાજમાં વધુ ફાંટાઓ પડે તેમ મને જણાતું નથી. પણ એક સંભાવના સમાજમાં ઉદ્‌ભવી રહી છે કે સમાજમાં સ્વામીનારાય, સત્ય નારાયણ, આર્ય સમાજ, સ્વાધ્યાયી, પ્રણામી, કબીરપંથી, રામચંદ્ર ભગવાન તથા શિવને પોતાના ઇષ્ટ દેવ તરીકે માનનારો વર્ગ કેન્દ્રીય સમાજથી અલ્પીત થવાના એંધાણ અત્યારે દેખાઇ રહ્યાં છે. જે સમાજના ભાવી માટે હાનીકારક સાબિત થઇ શકે. શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એક સંપ્રદાયનું રૂપ હોય તેમ જણાઇ રહ્યું છે.

હું ભગવાન લક્ષ્મીનારાયણ અને માર્ગદર્શક સંતોનો વિરોધ નથી કરતો (વિરોધી નથી.) પ્રશંસક છું. પણ જે રીતે સમાજ એટલે લક્ષ્મીનારાયણ અને લક્ષ્મીનારાયણ એટલે સમાજ આ ભાવના બળવતર બનતી જશે. તો ભવિષ્યમાં સમાજને નુકશાન થવા સંભવ છે. મારા અનુભવોને આધારે જણાવું છું કે જ્યારે જ્યારે સમાજો પર સંપ્રદાયો હાવી થયાં છે ત્યારે ત્યારે સમાજની ગરીમા ઘટી છે.

એટલું જ નહીં અત્યારે સમાજમાં બહાર ગામ ઘણી જગ્યાએ કચ્છ કડવા પાટીદાર સમાજની બદલે કચ્છ કડવા પાટીદાર શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સ્થાપનાઓ થતી રહેશે. તો ઉપર જણાવેલ સમુદાયના ભાઇઓ સમાજથી દૂર થતા જશે. બીજું આપે જણાવ્યું છે કે સમાજ સુધારક પૂ.નારાયણબાપા આર્ય સમાજી હતા, તે વાત પણ અર્ધ સત્ય છે. પૂ. નારાયણ બાપાના જીવન ચરિત્ર્યનું એક પાનું અછૂતું રહી જવા પામ્યું છે. પૂ. નારાયણજી બાપાના માતાપિતા સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાય હતા (જુઓ કર્તવ્યના પંથે પેજ નં.-૩ સંપાદક વાલજીભાઇ જીવરાજ લીંબાણી-વીરાણી મોટીવાળા) જોઇ જવા તથા કુર્મિ ક્ષત્રિયોનો ઇતિહાસ હિન્દી આવૃત્તિમાં પૂ. નારાયણજી બાપાનું ઉદવપુંડ તિલક (જે સ્વામિનારાયણના અનુયાયીઓ કરતા હોય છે તેવું) સાથેનો ફોટો પ્રકાશિત થયેલ છે. તે જોઇ જવા વિનંતી છે. એટલે પૂ. નારાયણજી બાપાના માતાપિતા સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હોવાથી તેઓ જન્મથી સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી હતાં. એટલું જ નહીં પૂ. નારાયણજી બાપાએ તે સમયમાં શ્રી સ્વામીનારાયણ મંદિર ભૂજે કડવા પાટીદારના ભાઇઓને એમ કહેતા કે તમારો સમાજ પીરાણા પંથી છે. તેથી તમોને સાધુ દિક્ષા (સંત દિક્ષા) આપી ન શકાય. આની સામે તે સમયના આપણા સ્વામિનારાયણના અનુયાયીઓએ પૂ. નારાયણજી બાપાની આગેવાનીમાં સાધુ દિક્ષા પ્રકરણના સુખદ ઉકેલ માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ સ્વામિનારાયણ મંદિર ભૂજના જડ વલણને કારણે આ પ્રકરણનો સુખદ ઉકેલ ના નિળકતાં પૂ. નારાયણજી બાપા નિરાશ થયાં હતાં. એટલું જ નહીં ભૂજ સ્વામિનારાયણ મંદિરના જડ વલણને કારણે સમગ્ર સમાજ સ્વામિનારાણ સંપ્રદાય હેઠળ સંગઠિત થાય. પૂ. નારાયણજી બાપાની સામાજિક સુધારણાની ચળવળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનું મોટું યોગદાન રહ્યું હતું. તે આપણને કર્તવ્યના પંથે તથા પિરાણા પોલના પુસ્તકમાં જોવા મળે છે. સ્વામિનારાયણ મંદિર ભૂજના જકી વલણથી તથા પૂ. રતનશીભાઇ સાથે ઉભરેલા વિવાદોથી તથા પૂ. નારાયણજી બાપા આર્ય સમાજના સંતોના સંપર્કમાં આવવાથી પાછલા વર્ષોમાં તેમનો ઝુકાવ આર્ય સમાજ તરફ હતો. તેમ કહી શકાય.

<u>ઉપાય :</u> આપણી સમાજની કુળ દેવી માઁ ઉમિયાજી છે.

(વધુ પાન -૧૩ ઉપર)

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n8/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

શ્રી અ.ભા.ક.ક.પા. સમાજની દિલ્હી ખાતે મળેલી કારોબારી સભામાં લેવાયેલ નિર્ણય

કેન્દ્રીય સમાજનું કાર્યાલય અમદાવાદમાં ખુલશે

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની કારોબારી સભા તા. ૧૧/૧/૧૪ના રોજ સવારના ૯-૦૦ કલાકે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દિલ્હીના યજમાન પદે કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી ગંગારામભાઇ હીરાલાલ સાંખલાના અધ્યક્ષસ્થાનેમળેલ. પ્રથમ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દિલ્હીના ત્રિવેણી મહોત્સવ આયોજન સમિતિના-પ્રમુખશ્રી રવિલાલ કરસન સેંઘાણી દ્વારા સ્થાન ગ્રહણ અને શાલ તથા મોમેન્ટોથી કારોબારી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું. પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કર્યા બાદ કારોબારી સભા શરૂ કરવામાં આવી હતી. જેનું સંચાલન મંત્રીશ્રી વાલજીભાઇ ચૌહાણે કરેલ. આવનાર સભાસદોને આવકાર અને શાબ્દીક સ્વાગત મહામંત્રીશ્રી માવજીભાઇ કેસરા ભગતે કરેલ.

એજન્ડા નં.-૧ : ગત કારોબારી સભાની મીટીંગની મિનીટ્સનું વાંચન : તા. ૨૦-૮-૧૩ની મીનીટ્સનું વાંચન મંત્રીશ્રી માવજીભાઇ છાભૈયાએ કરેલ જે મીનીટ્સને સર્વાનનુમતે બહાલી આપવામાં આવેલ.

એજન્ડા નં.-૨ : આવેલ અગત્યના પત્રોનું વાંચન અને સમીક્ષા : પત્રોનું વાંચન મંત્રીશ્રી નરસિંહભાઇ નારણ સાંખલાએ કરેલ. સાંગલી જીલ્લા સનાતન સમાજના આજીવન સભ્ય બનવા અંગે પત્ર. મંત્રીશ્રી વાલજીભાઇ ચૌહાણે જણાવેલ કે જે સભ્યોને કેન્દ્રીય સમાજના આજીવન સભ્ય બનવું હોય તેમણે સ્થાનિક સમાજના અભિપ્રાય સાથેનું ફોર્મ જે તે વિસ્તાર ઝોનમાં મોકલાવનું રહેશે. ઝોન ફોર્મની ચકાસણી કરીને કેન્દ્રીય સમાજને મોકલાવશે તે ફોર્મ મંજૂર કરવામાં આવશે. ફોર્મ સાથે સભ્યફીની રકમ મોકલવી નહીં. ફોર્મ મંજૂર થયાની જાણ કરવામાં આવશે ત્યારે રકમ મોકલાવવી.

એજન્ડ નં. -૩ : સમાજની વર્તમાન ગતિવિધીનો અહેવાલ : મહામંત્રીશ્રી માવજીભાઇ ભગતે અહેવાલ આપતા જણાવેલ કે માંડવી હોસ્ટેલ બાબતે જે વાદ ચાલે છે તેમાં ચેરીટી કમિશ્નરે કેન્દ્રીય સમાજની તરફેણમાં ચુકાદો આપેલ છે. તે ચુકાદાની વિરુધ્ધમાં પાટીદાર સર્વોદય ટ્રસ્ટવાળા આગળ અપીલમાં ગયા છે એટલે કોર્ટ કાર્યવાહી ચાલુ છે. ભુજ ખાતેની જમીન બાબતે જણાવેલ કે ભુજ કલેક્ટરે જમીન માપણીનો ઓર્ડર આપી દીધેલ છે. જે કાર્ય ગતિમાં છે. ટૂંક સમયમાં તૈયાર થઇ ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવશે. ગાંધીનગરથી પણ ઝડપી કાર્યવાહી થાય તેવાં પ્રયત્નો ચાલુ છે. ઉમ્મીદ છે કે આ જમીન ટૂંક સમયમાં જ મંજૂર થઇ જશે તો સૌ કારોબારી મિત્રો પાસે ભંડોળની અપેક્ષા રાખવામાં આવે છે.

સમાજ આંતર જ્ઞાતિ લગ્નને મંજૂરી આપશે નહીં, કારણે કે આંતર જ્ઞાતિ લગ્નમાં ઘણી બધી સમસ્યાઓ સમાયેલી છે

ગાંધીધામ સમાજવાડી બાંધવાની વિસ્તૃત માહિતી ટ્રસ્ટીશ્રી રામજીભાઇ નાકરાણી તથા પ્રમુખશ્રી ગંગારામભાઇ સાંખલાએ આપેલ. સમાજવાડીના ખાતમૂર્હત વિધિ માટે અંદાજિત તા. ૧૦-૪-૧૪ રાખવી એવું નક્કી કરવામાં આવ્યું. મંત્રીશ્રી વાલજીભાઇ ચૌહાણે જણાવેંલ કે યુવાસંઘ દ્વારા અમદાવાદ મધ્યે ઓફીસ બનાવવાનું સૂચન આવેલ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. યુવા સંઘના પ્રમુખ શ્રી માવજીભાઇ દિવાણીએ અમદાવાદ ખાતે ઓફિસ અને સુવિધા કેન્દ્ર બનાવવા માટે વિસ્તૃત માહિતી આપેલ. સમાજના ઉપપ્રમુખશ્રી મનસુખભાઇ રૂડાણીએ અત્યાર સુધી થયેલ કાર્યવાહીની માહિતી આપેલ. મંત્રીશ્રી નરસિંહભાઇએ કુલ સ્કેવેરફૂટ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n9/mode/1up

realpatidar.com

અને તેના ભાવ અંગેની માહિતી આપેલ.

પ્રમુખશ્રી ગંગારામભાઇ સાંખલાએ જણાવેલ કે અમદાવાદ ખાતે ઓફીસ અંગેની પૂરી માહિતી મળેલ છે તો આપણે ઓફીસ ખરીદવા માટે મંજૂરી આપીએ. પ્રમુખશ્રીની અપીલને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. ઓફીસ ખરીદવામાં યુવાસંઘ સાથે સમાજના ઉપપ્રમુખશ્રી મનસુખભાઇ રૂડાણી તથા મહામંત્રીશ્રી નરસિંહભાઇ સાંખલાને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવાની રહેશે. ઓફીસ માટે ફંડ યુવાસંઘ દ્વારા ઉભું કરવામાં આવશે, જરૂર જણાશે તો સમાજ પણ સહકાર આપશે એવું નકકી કરવામાં આવ્યું.

પ્રમુખશ્રી ગંગારામભાઇ સાંખલાએ સમાજ વિકાસ અંગે જણાવેલ કે ભૂજમાં જમીન, વિદ્યાનગરમાં હોસ્ટેલ અને ગાંધીધામમાં સમાજવાડીના પ્રોજેક્ટ ચાલુ છે તેમાં સર્વેને સહયોગ આપવા જણાવેલ. વધુમાં માંડવી મધ્યે લખુભાઇ વીરજી ધોળુ વિદ્યાર્થી હોસ્ટેલ અંગે માહિતી આપતા વાંઢાય સંસ્થાનના પ્રમુખ અને પાટીદાર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી રવિલાલભાઇ રામજીયાણીને જણાવેલ કે તમો પાટીદાર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી છો તો મેઘજીભાઇ જેઠાને સાચી સલાહ આપો કે ખોટા જુઠાણા ફેલાવે નહીં. તમો પોતે પણ કબૂલ કરો છો કે માંડવી હોસ્ટેલની મિલકત કેન્દ્રીય સમાજની છે તો તે મીલકત સમાજમાં પાછી આવી જાય તેવા પ્રયત્નો કરો.

રવિલાલભાઇ રામજીયાણીએ જણાવેલ કે, સમાધાન માટે પ્રયત્નો કરેલ છે પણ સફળતા મળેલ નથી. અત્યારે પણ અમો પ્રયત્નશીલ છીએ. જરૂર પડે હું સમાજ સાથે છું.

પ્રમુખશ્રી ગંગારામભાઇ સાંખલાએ જણાવેલ કે મેઘજીભાઇ દ્વારા ગેરસમજણ ફેલાવવાના જે પ્રયત્નો થઇ રહ્યા છે તે બીલકુલ વ્યાજબી નથી. તમો વાંઢાય સંસ્થાનના પ્રમુખ છો જેથી આવાં ખોટા કામ કરવાવાળા ટ્રસ્ટમાંથી તમોએ રાજીનામું આપી દેવું જોઇએ. અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી જવું જોઇએ. ઉમા દર્પણમાં પણ સમાજ વિરુધ્ધ લખાણો ન છપાય. તેની તમોએ કાળજી લેવી જોઇએ. આ ચર્ચામાં જીવરાજભાઇ રામાણી-નાગપુર, હીંમતભાઇ ખેતાણી-મુંબઇ, પ્રેમજીભાઇ કેસરાણી-નવી મુંબઇ, દામજીભાઇ વાસાણી-ભુજ વિગેરે ભાગ લીધેલ.

એજન્ડા નં. -૪ કેન્દ્રીય સમાજ રચિત ૧૫ સમિતિના કાર્યનો અહેવાલ : હાજર રહેલ સમિતિના સભ્યોએ થયેલ કાર્યવાહીનો અહેવાલ આપેલ જેની નોંધ લેવામાં આવેલ છે. પ્રમુખશ્રી ગંગારામભાઇ જણાવેલ કે આગામી દરેક કારોબારીમાં સમિતિએ કરેલ કાર્યવાહીનો અહેવાલ આપવાનો રહેશે. માટે દરેક સમિતિએ સક્રિય રહીને કામ કરવાનું રહેશે. જે ઝોનનું છેલ્લા ત્રણ વર્ષનું વિકાસ દાન મોકલવાનું બાકી હોય તેમણે વહેલી તકે મોકલી આપવું.

એજન્ડ નં.-૫ : પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે : ઉપપ્રમુખ શ્રી મનસુખભાઇ રૂડાણીએ પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા માટે આવેલ પત્રો અંગે માહિતી આપી. મંત્રીશ્રી વાલજીભાઇ ચૌહાણે જણાવેલ કે ઝોનની કારોબારીની મુદ્દત કેન્દ્રીય સમાજની કારોબારીની મુદ્દત પ્રમાણે હોવી જોઇએ. ઝોનની કારોબારી અને હોદ્દેદારોની નિમણૂંક જુલાઇ માસમાં થવી જોઇએ જે ઝોનોએ વચનમાં કારોબારી રચના કરી હોય તેમણે આવતા જુલાઇ માસમાં ફરીથી કારોબારીની નિમણૂંક કરવાની રહેશે અને હોદ્દેદારોના નામો કેન્દ્રીય સમાજની આગામી ઓગસ્ટ માસની વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવાના રહેશે જેથી નવી કારોબારીમાં સમાવેશ કરી શકાય.

પ્રમુખશ્રી ગંગારામભાઇએ જણાવેલ કે ઝોનોની કારોબારીની રચના ઝોનના નિતીનિયમો પ્રમાણે જ થવી જોઇએ. જેઠાભાઇ ચોપડાએ જણાવેલ કે સમાજમાં જવાબદારી લેવી હોય તો કામ કરવું જોઇએ. માંડવીવાળાએ સમાજનું હીત જોઇને કામ કરવું જોઇએ. સમાજનો વિકાસ પૈસા વગર થતો નથી. સમાજ સંગઠીત રાખવો જરૂરી છે. સમાજ સંગઠીત હશે તો જ સમાજનો વિકાસ થઇ શકશે.

ભરતભાઇ પોકારે સગપણ સમસ્યા અંગે જણાવેલ કે સમાજે આંતર

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n10/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

જ્ઞાતિ લગ્ન અંગે મંજૂરી આપવી જોઇએ. આ બાબતે પ્રમુખશ્રી ગંગારામભાઇએ યોગ્ય ખુલાસાઓ કરતા જણાવેલ કે સમાજ ક્યારે પણ આંતર જ્ઞાતિ લગ્નને મંજૂરી આપશે નહીં કારણે કે આંતર જ્ઞાતિ લગ્નમાં ઘણી બધી સમસ્યાઓ સમાયેલી છે.

સમાજના ટ્રસ્ટીશ્રી રામજીભાઇ નાકરાણીએ જણાવેલ કે સુવર્ણ જયંતિ મહોત્સવમાં દાન નોંધાવેલ તે બાકી હોય તેમણે તાત્કાલીક મોકલી આપવું જોઇએ.યુવાસંઘની માહિતી પ્રમુખશ્રી માવજીભાઇ દિવાણીએ તથા મહામંત્રીશ્રી ગૌતમભાઇ કેસરાણીએ આપેલ. મહિલા સંઘની માહિતી પ્રમુખશ્રી ઝવેરબેને તથા મહામંત્રીશ્રી સોનલબેને આપેલ.

પ્રમુખશ્રી ગંગારામભાઇએ ઉપસંહાર કરતા જણાવેલ કે આજની કારોબારી સભામાં આપ સૌએ ખૂબ જ સહયોગ આપ્યો તે બદલ ધન્યવાદ પાઠવું છું. સમાજ વિકાસ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. અમદાવાદ મધ્યેય ઓફીસ લેવાનો જે નિર્ણય લેવાયો તે યોગ્ય જ છે. સમાજ વિકાસ માટે દિવાળી બોણી લેવાનું નક્કી કરેલ છે તેના માટે ધ્યાન આપી વધારે દિવાળી બોણી આવે તે માટે આપણે સૌએ પ્રયત્નો કરવાની જરૂર છે. આભારદર્શન મંત્રીશ્રી નરસિંહભાઇ સાંખલાએ કરેલ. રાષ્ટ્રગાન બાદ પ્રમુખશ્રીની અનુમતિથી સભા પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

જિંદગી એ શું ચીજ છે..?

જિંદગી શું ચીજ છે
ગાઇ શકો તો ગીત છે
સુખ મળે ન દુઃખ મળે
તેમની એ રીત છે
અંધ થઇને ના ચાલશો
માર્ગમાં પણ ભીંત છે
જો શકો જીરવી તમે
હારમાં પણ જીત છે.
જો બનો પ્રેમી તમે
હર વ્યક્તિ મનમીત છે.
હાનિ ને તો હવે
મોત ભી પણ પ્રીત છે.

ધુલીયા સમાજના (મહારાષ્ટ્ર) યુવા મંડળની કારોબારીની રચના

મગનભાઇ પેથાણી
પ્રમુખ

દિનેશભાઇ હળપાણી
મહામંત્રી

ધુલીયા કચ્છ કડવા પાટીદાર યુવા મંડળની જનરલ મિટીંગ તા. ૨૫/૧/૧૪ શનિવારના પાટીદાર સમાજ ભુવન ખાતે યુવા મંડળના પ્રમુખ શ્રી મગનભાઇ પેથાણીના અધ્યક્ષ સ્થાને મળેલ. આ મિટીંગમાં યુવા મંડળના મહામંત્રીશ્રી દિનેશભાઇ ધોળુ દ્વારા મિનિટ બુકનું વાંચન કરવામાં આવ્યું ત્યાર બાદ મંડળના ખજાનચી શ્રી કાંતિભાઇ ચૌધરીએ યુવા મંડળના હિસાબોની રજૂઆત કરેલ. ત્યાર બાદ યુવા મંડળના વર્તમાન કારોબારીનો કાર્યકાળ સમાપ્ત થતા આગામી બે વર્ષ માટે નીચે મુજબની નવી કારોબારીની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ શ્રી મગનભાઇ રામજીભાઇ પેથાણી (ટોડીયા), ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ જીવરાજભાઇ ધોળુ (નાગલપર), મહામંત્રી શ્રી દિનેશભાઇ કાનજીભાઇ હળપાણી (મથલ), સહમંત્રી શ્રી પ્રવિણભાઇ લાલજીભાઇ રવાણી (ખોંભડી), ખજાનચી શ્રી રમેશભાઇ પુરુષોત્તમભાઇ રામજીયાણી (નેત્રા), સહખજાનચી શ્રી મણીલાલ શામજીભાઇ ચવ્હાણ (ખોંભડી)ની વરણી કરવામાં આવેલ છે. પુનઃ વરાયેલા પ્રમુખશ્રી મગનભાઇ પેથાણીએ વર્તમાન કારોબારીના સભ્યો ઉપર પુનઃ વિશ્વાસ મુકવા બદલ ઉપસ્થિત સર્વે સભ્યોનો આભાર માની સર્વેના સહયોગથી યુવા મંડળના વિકાસના કામો સતત ચાલુ રાખવાની ખાત્રી આપી હતી.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 9 of 40

https://archive.org/details/bk1391/page/n11/mode/1up

realpatidar.com

નખત્રાણામાં કચ્છ રીજીયન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ કચ્છ રીજીયન દ્વારા તા. ૧૫-૧૨-૧૩થી ચાલુ થયેલ શ્રી ધોરમનાથ ડેવલોપર્સ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૪-૧-૧૪ના રાત્રે પૂર્ણ થયેલ. તા. ૪-૧-૧૪ના રમાયેલ ફાઇનલ મેચમાં ગઢશીશા (ફ્રેન્ચાઇઝી- જે.પી. ગ્રુપ નખત્રાણા) પાટીદાર યુવક મંડળની ક્રિકેટ ટીમે નખત્રાણા મધ્ય વિભાગ (ફ્રેન્ચાઇઝી - એચ.કે. ટીમ્બર ગાંધીધામ)ની ટીમને પરાજય આપીને ચેમ્પીયન ટ્રોફી જીતી લીધેલ.

યુવાસંઘ કચ્છ રીજીયન પ્રમુખ પ્રવિણભાઇ ધોળુના અધ્યક્ષ સ્થાને તા. ૧૫-૧૨-૧૩ના સાંજે ૭-૦૦ વાગે યોજાયેલ ઉદ્‌ઘાટન સમારોહમાં કેન્દ્રીય પાટીદાર સમાજ ઉપપ્રમુખ મણિભાઇ ભગત, મહામંત્રી માવજીભાઇ ભગત, કેન્દ્રીય યુવાસંઘના મહામંત્રી ગૌતમભાઇ કેશરાણી, ગ્રીન કાઉન્સીલના પ્રમુખ અમૃતભાઇ નાકરાણી, પી.જી.વી.એલ.ના નાયબ ઇજનેર સી.કે. સોઢા, નખત્રાણા નવાવાસ પાટીદાર મસાજના પ્રમુખ ડાયાભાઇ સેંઘાણી, મધ્ય વિભાગ પાટીદાર સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ભગત, પશ્ચિમ વિભાગના પાટીદાર સમાજના પ્રમુખ રવજીભાઇ લિંબાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટના સમગ્ર કચ્છભરમાંથી કુલ ૪૮ ટીમોએ ભાગ લીધેલ જેમાં ૭૨૦ સનાતન પાટીદાર સમાજના યુવા ખેલાડીઓએ ઉત્તમ દેખાવ દ્વારા સામાજિક એકતાનું પ્રતિબિંબ રજૂ કરેલ. આ ટુર્નામેન્ટનું યુવાસંઘના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ નખત્રાણા વિસ્તારના ૬૦ જેટલા યુવાનોએ સફળ આયોજન સંભાળેલ. ૨૦ દિવસ ચાલેલ આ ટુર્નામેન્ટે ભારે આકર્ષણ સમગ્ર કચ્છ અને ભારતભરમાં મેઇલ અને વોટ્‌સએપ દ્વારા ઉભું કરેલ.

યુવાસંઘ કચ્છ રીજીયનના પ્રમુખ પ્રવીણભાઇ ધોળુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય પાટીદાર સમાજના મહામંત્રી માવજીભાઇ ભગત, કેન્દ્રીય પાટીદાર યુવાસંઘના પ્રમુખ માવજીભાઇ દિવાણી, ભુજના ડીવાય.એસ.પી. તેજલ પટેલ, પશ્ચિમ કચ્છ નખત્રાણાના ડીવાય.એસ.પી. ચિંતન તેરૈયા, કેન્દ્રીય યુવાસંઘના ગ્રીન લેન્ડ કાઉન્સીલના પ્રમુખ અમૃતભાઇ નાકરાણી, કેન્દ્રીય રમત-ગમતના કન્વીનર હરીલાલ રૂડાણી, કેન્દ્રીય યુવાસંઘના પી.આર.ઓ. અશોકભાઇ ભાવાણી, જાણીતા તબીબ ડૉ. શાન્તીલાલ સેંઘાણી, પાણી પુરવઠાના (પશ્ચિમ કચ્છ) એકઝીકયુટીવ એન્જિનિયર શંકરભાઇ કાનાણી, ટી.ડી.ઓ. નખત્રાણા અશોકભાઇ વાણીયા, નખત્રાણા સરપંચ ડાયાભાઇ સેંઘાણી, ટુર્નામેન્ટના વિજેતા ટ્રોફીના દાતાશ્રી મગનભાઇ નાકરાણી, રનર્સઅપ ટ્રોફીના દાતા વસંતભાઇ ચોપડા વતી પ્રવિણભાઇ રૂડાણી, ગોકુલધામ સોસાયટી તી નિલેશભાઇ રામાણી, ટુર્નામેન્ટના ફ્રેન્ચાઇઝી કિરીટભાઇ ભગત (ભગત બિલ્ડર્સ), ધિરજ રૂડાણી (એચ.કે. ટીમ્બર), સુરેશ ગોગારી (જી.પી. ટીમ્બર), મોહનભાઇ લિંબાણી (અંબિકા ટ્રેડર્સ), ભવાનભાઇ પોકાર (લક્ષ્મીનારાયણ ચેલેન્જર્સ), જગદીશભાઇ વાડીયા (જે.પી. ગ્રુપ), રમેશ પોકાર (હોટલ રૂદ્રાક્ષ), ભરતભાઇ કેશરાણી (કિશાન ફ્રુટ) આ ઉપરાંત હરીભાઇ ધોળુ, બાબુભાઇ ચોપડા, નાનજીભાઇ નાકરાણી, ભાઇલાલભાઇ છાભૈયા તથા છગનભાઇ પારસીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ ઉપર પ્રાસંગીક પ્રવચનમાં ડૉ. શાંતિલાલ સેંઘાણી અને ડીવાય.એસ.પી. તેજલ બહેને યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી બહેનોની પણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા માટે આયોજકોને સૂચન કર્યું.

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n12/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

ડીવાય.એસ.પી. તેરૈયા પોલીસની કોઇપણ પ્રકારની જરૂરત હોય તો દરેકને હિંમતથી રજૂઆત કરવાની ખાસ સૂચના આપી. મહામંત્રી માવજીભાઇ ભગતે સમગ્ર કચ્છના યુવાનોને જોડતા આ કાર્યક્રમ બદલ યુવાસંઘને ધન્યવાદ આપ્યા. માવજીભાઇ દિવાણી અને અમૃતભાઇ નાકરાણીએ યુવાસંઘના દરેક મિશનમાં જોડાવાની દરેક યુવાનોને હાકલ કરેલ.

સમગ્ર કચ્છના પાટીદાર બિઝનેશ મેન તરફથી મેન ઓફ ધ મેચના દાતા તરીકે અને ગ્રાઉન્ડની બાઉન્ડ્રી પર રાખેલ બેનરના દાતા તરીકે સહયોગ મળેલ. આ સમાપન કાર્યક્રમમાં લગભગ ૮૦૦૦ જેટલાં પાટીદાર ભાઇ-બહેનો હાજર રહ્યા હતાં.

ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે હિરેન પારસીયા નખત્રાણા ગ્રુપ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ થયેલ. ટુર્નામેન્ટને સફળ બનાવવા યુવા સંઘ કચ્છ રીજીયનના સર્વે હોદ્દેદારો સભ્યો અને નખત્રાણા યુવક મંડળનાદરેક સભ્યોએ છેલ્લા દોઢ મહિનાથી સખત મહેનત કરેલ.

ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન પિયુષ રૈયાણી, મેન ઓફ ધ સીરીઝ દિનેશ નાકરાણી, બેસ્ટ બોલર ચેતન બાથાણી, બેસ્ટ ફીલ્ડર ભાવેશ કેશરાણી, બેસ્ટ વિકેટ કિપર જીગ્નેશ પારસીયા, ટુર્નામેન્ટ ફાસ્ટેડ ફીફ્ટી મયુર કેશરાણી, ટુર્નામેન્ટ હાઇએસ્ટ સીક્સર પિયુષ રૈયાણી (૨૪), ટુર્નામેન્ટ હાઇએસ્ટ ફોર (૪) કૃણાલ વાઘડીયા (૨૦) રહ્યા હતા. આ ટુર્નામેન્ટ દરમિયાન યુવા સુરક્ષા કવચમાં ૧૫૦ યુવાનો જોડાયા હતા. પ્રમુખશ્રી પ્રવિણભાઇ ધોળુ એ સફળ આયોજન બદલ નખત્રાણા વિસ્તારના યુવાનોને અભિનંદન આપ્યા. સંચાલન પ્રો. કે. વી. પાટીદાર (ભુજ) મહામંત્રી જયંતીલાલ પારસીયાએ કરેલ. આભારવિધિ ઉપપ્રમુખ શૈલેષ પોકારે કરેલ.

વસંત પંચમીના પવિત્ર દિવસે સમગ્ર ભારતભરમાં ક.ક.પા. સમાજ દ્વારા

૧૬ જગ્યાએ યોજાયેલ સમૂહ લગ્નોત્સવોમાં ૧૮૯ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા

અખાત્રીજ, વસંત પંચમી અને તુલસી વિવાહના દિવસે સમગ્ર ભારતભરમાં ફેલાયેલા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ જગ્યાએ ખૂબ જ સુંદર, સુવિધાપૂર્ણ અને સાદગી પૂર્ણ સંસ્કારી વાતાવરણમાં સંપૂર્ણ વિધી વિધાન પૂર્વક સમૂહલગ્નોત્સવો યોજાયે છે. દર વર્ષે આપણી સમાજના ૬૦૦થી એક હજાર જેટલા જોડકાઓ પ્રભુતામાં ડગ માંડે છે.

તાજેતરમાં ગત તા. ૪/૨/૧૪ના રોજ સમગ્ર ભારતભરમાં વિવિધ ૧૬ જગ્યાઓ એ સમૂહ લગ્નોત્સવો યોજાયા હતા. જેમાં ૧૮૯ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડી સમાજજનોના આર્શિવાદથી ગૃહસ્થ જીવનની શરૂઆત કરી હતી. દેશના વિવિધ પ્રાંતોમાં યોજાયેલ સમૂહ લગ્નોત્સવની માહિતી બાજુમાં આપેલા કોષ્ટકમાં આપવામાં આવી છે. સૌથી વધુ ધનસુરામાં ૫૧ અને સૌથી ઓછા વાંઢાયમાં ૧ લગ્ન યોજાયા હતા.

સ્થળ	સંખ્યા
ધનસુરા (સા.કાં.)	૫૧
નાગપુર	૨૦
નડીઆદ	૧૮
કલોલ	૧૬
ડોંબીવલી (મુંબઇ)	૦૭
ઘાટકોપર (મુંબઇ)	૦૫
નાસીક	૧૨
મંડ્યા	૧૧
ધારવાડ	૧૦
રાયપુર	૧૦
સાંગલી	૦૫
દક્ષિણ ભારત	૦૪
પુના	૦૪
સીકંદરાબાદ	૧૩
કોલકાત્તા	૦૨
વાંઢાય	૦૧
કુલ	૧૮૯

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n13/mode/1up

realpatidar.com

દિલ્હી સમાજના યજમાનપદે 'ત્રિવેણી મહોત્સવ'માં યુવાસંઘની કારોબારી સભા મળી

(યુવાસંઘના પ્રવક્તા અશોક જે. ભાવાણી દ્વારા)

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દિલ્હી પોતાની સ્થાપનાના આઠ દાયકા વટાવી ચૂક્યો છે. તથા તરૂણ મિત્ર મંડળ દિલ્હી પાંચ દાયકા અને મહિલા મંડળ દિલ્હી ચાર દાયકા પૂર્ણ કરી સમાજમાં સંગઠન અને સેવાની જ્યોત જલતી રાખી છે. જેના ભાગરૂપે સમાજનો હીરક મહોત્સવ અને તરૂણ મિત્ર મંડળ અને દિલ્હી મહિલા મંડળનો સુવર્ણ જયંતિ મહોત્સવ તા. ૯ થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન દિલ્હી સ્થાનિક સમાજ અને કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઇ સાંખલાના અધ્યક્ષ સ્થાને ભવ્યાતિભવ્ય રીતે યોજાઇ ગયો. જેમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ દરમ્યાન તરૂણ મિત્ર મંડળ અને સાબર રીજીયનના સંયુક્ત ઉપક્રમે જ્ઞાતિના આદ્ય સુધારક નારાયણ રામજી લીંબાણીના જીવન પર આધારિત સત્ય સંઘર્ષ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ મહોત્સવમાં આયોજકો દ્વારા કેન્દ્રીય સમાજની ત્રણેય પાંખના કારોબારી સભ્યોને મહોત્સવના આનંદમાં સહભાગી થવા નિમંત્રણ આપ્યું હતું. જેમાં યુવાસંઘના હોદ્દેદારો દ્વારા કારોબારી સભાનું આયોજન તા. ૧૦-૧-૧૪ને શુક્રવારે બપોરે ૨-૩૦ કલાકે પાટીદાર ભવન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ સભા યુવાસંઘના પ્રમુખશ્રી માવજીભાઇ દિવાણીની અધ્યક્ષતામાં મળી હતી. શરૂઆતમાં યુવાસંઘના મહામંત્રીશ્રી ગૌતમભાઇ કેશરાણી (મુંબઇ) એ સૌને શબ્દો વડે આવકારી મીટીંગની કાર્યવાહી એજન્ડા મુજબ કરી હતી. યુવાસંઘના મંત્રી શ્રીમતી દમયંતીબેન ભાવાણીએ ગત સભાનું પ્રોસેડીંગનું લંબાણ પૂર્વક વાંચન કર્યું હતું. સંઘના આવક-જાવકના હીસાબો કોષાધ્યક્ષ શ્રી તુલસીભાઇ દિવાણી (રાયપુર) એ રજૂ કર્યા હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આવેલ પત્રોનું વાંચન કાઉન્સીલ મંત્રી પરેશ માવાણી (મુંબઇ)એ કર્યું હતું. ત્યારબાદ યુવાસંઘના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઇ માવાણી (મુંબઇ) એ વિવિધ સમિતિના લીડર તરીકે સમિતિના સમાજ અને વ્યક્તિ, ઉત્કર્ષ ના કાર્યોને બિરદાવ્યા હતા. જેમાં એક પછી એક સમિતિ લીડરને રજૂ કરી પ્રવૃત્તિ અહેવાલ આપ્યો હતો. જેમાં વાય.એસ.કે.ના વિશ્રામભાઇ વતી વસંતભાઇ ધોળુએ વિસ્તૃત રીપોર્ટીંગ કર્યું હતું. શ્રી ધીરજભાઇ ડાયાણીએ બીજનેશ સેલનું વર્તમાન અને ભવિષ્યની ઝાંખી કરાવી હતી. એજ્યુકેશન લીડર કિરીટભાઇ પોકારએ સ્નેહગાંઠની સફળતા અને કચ્છની સ્નેહગાંઠ ૩/૧ની વાત કરી હતી. પંચામૃત-સરસ્વતી સન્માન, બોલે પાટીદાર અને માર્ગદર્શન શિબિરી તમામ રીજીયનો ધમધમતા રહ્યા હતા. આગામી દિવસોમાં પણ કેલેન્ડર પ્રમાણે કાર્યક્રમો થશે તેવી જાહેરાત કરી હતી. સામાજિક અને આધ્યાત્મિક સમિતિના વિઠ્ઠલભાઇ દિવાણીએ દરેક ઘરમાં પરિવાર પ્રાર્થના, યુવા શિબિર, બાળ શિબિરના આયોજનની માહિત આપી હતી. કૃષિ પર્યાવરણ લીડર દામજીભાઇ વાસાણી એ કોટડાનો ઇઝરાયેલ પ્રવાસની વાત કરી હતી. મીશન રાજકીયના લીડર જગદીશાઇ દિવાણીએ છત્તીસગઢ દેવજીભાઇની સિધ્ધીની જાણકારી આપી હતી.

ખૂબ જ ઉત્સાહી અને પોતાના કાઉન્સીલે સતત સમાજની સેવાકીય પ્રવૃત્તિ ધમધમતું રાખતા કાઉન્સીલ પ્રમુખ શ્રી અમૃતભાઇ નાકરાણી એ પોતાના ક્ષેત્રના પ્રમુખો પ્રવિણભાઇ

દિલ્હી સમાજનો હીરક મહોત્સવ તથા યુવા અને મહિલા પાંખનો સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ભારતભરમાંથી સામાજિક અગ્રણીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ

realpatidar.com

realpatidar.com

ધોળુ, વસંતભાઇ ધોળુ અને શંકરભાઇ દિવાણીને સુંદર પ્રવૃત્તિ બદલ બિરદાવ્યા હતા તેજ ક્રમમાં શંકરભાઇ રવાણી, ભગવાનભાઇ રવાણી સરદાર પટેલ રીજીયન મોહનભાઇ ધોળુ, મહાત્મા ગાંધી રીજી. ડૉ. વિઠ્ઠલભાઇ ભાવાણી એ તથા પરસોત્તમભાઇ રાયપુર એ કાઉન્સીલ પ્રમુખ તરીકે પોતાના વિસ્તારમાં થયેલ પ્રવૃત્તિની પ્રશંસા કરી વધુ કાર્યો માટે પ્રેરણા આપી હતી.

પરેશભાઇ માવાણીએ મંત્રી તરીકે ફોરેસ્ટ કાઉન્સીલના ધનજીભાઇ ભાવાણી (ઓડીટર) અને નટુભાઇ નાગપુરની પ્રવૃત્તિની નોંધ લીધી હતી. મુકત મંતવ્યોમાં આમંત્રીત અલ્પા નાકરાણી, મોહનભાઇ પેટલાદ, પ્રેમજીભાઇ કેશરાણી (સલાહકાર), ભગવાનભાઇ-અદમાવાદ, ધનજીભાઇ ભાવાણી (ઓડીસા), બાબુભાઇ (બારડોલી), દામજીભાઇ વાસાણી, પ્રવિણભાઇ ધોળુ, શૈલેષભાઇ પોકાર (કચ્છ), નટુભાઇ (નાગપુર) એ પોતાના મંતવ્યો સભામાં આપ્યા હતા. અને ગ્રીન લેન્ડ કાઉન્સીલની ખાલી પડેલ મંત્રીની જગ્યા પર દિલ્હીના ખૂબ જ ઉત્સાહી યુવાન જગદીશભાઇ ચૌહાણને પસંદ કરાયા હતા. અને અમદાવાદ ખાતે સુવિધાકેન્દ્રની મંજૂરી સભાએ આપી હતી તથા યુવાસંઘમાં કમિટી લીડરની ઉંમર ૫૦ વર્ષ સુધીની હોય તે ચર્ચા પણ કરવામાં આવી હતી.

છેલ્લે ગૌરાંગભાઇ ધનાણી પછી પ્રમુખ શ્રી માવજીભાઇ દિવાણીએ પ્રમુખ સ્થાનેથી પોતાના વિચારો રજૂ કર્યા હતા. યુવાસંઘના પ્રવકતા અશોકભાઇ ભાવાણી (ધનસુરા) એ દિલ્હી સમાજ ગંગારામબાપા અને તેમની ટીમ ડૉ. રવિભાઇ અને જગદીશભાઇ ચૌહાણ અને મહિલા ટીમ તરૂણ મિત્ર મંડળ વગેરેનો આભાર માન્યો હતો. મહામંત્રીશ્રી ગૌતમભાઇ કેશરાણી એ સભાની પૂર્ણતાની જાહેરાત કરી હતી.

(વધુ પાન -૬ ઉપર)

વાચકનો પત્ર...

એવી જ રીતે આપણા સમાજના ઇષ્ટ દેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણને સમગ્ર સમાજે સ્વીકારીને શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ (સંસ્કારધામ કેન્દ્ર દેશલપર)ને શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના નેજા હેઠળ આવરી લેવી જોઇએ. (બંને સંસ્થાઓને જોડી એક કરવામાં આવે) બંને સંસ્થાઓને આપણે નહિ જોડી શકીએ તો આપણી સમાજના અન્ય સંપ્રદાયના ભાઇઓએ પોતાની ધાર્મિક સંસ્થાઓ બનાવી છે. તેવી જ રીતે શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ આપણા સમાજના ભાઇઓ દ્વારા બનેલી સંસ્થા બની રહેશે તે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની સંસ્થા નહિં ગણાય.

આપનો વિશ્વાસુ, નરસિંહભાઇ
પટેલના જય ઉમિયાજી

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n15/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

શ્રી ઘડુલી પાટીદાર સમાજ દ્વારા યોજનાર

'પાટીદાર યુથ યુનિટી ફોર ઘડલુ-૨૦૧૪' કાર્યક્રમ

(પ્રેસનોટ)

શ્રી ઘડુલી પાટીદાર સમાજે અતિતના સ્મરણોના ઓજસ સાથે અવિસ્મરણીય સ્નેહ-સરવાણીનું સર્જન કર્યું છે. ઇ.સ. ૧૯૯૬માં સ્થપાયેલ શ્રી ઘડુલી પાટીદાર યુવક મંડળની રચના પ્રવર્તમાન સમય સુધી અનેકવિધ ચડાવઉતારના અનુભવરૂપી ઓસડના આધારે ભાવિ વિકાસની કેડી નહીં પણ રાજમાર્ગ કંડારવાનો પાયો સુદઢ કર્યો છે.

ઘડુલી ગામમાં વસતા યુવાનો અને ભારતભરમાં વસતા ઘડુલી સમાજના યુવાનો સાથે મળી સંગઠનને મજબૂત બનાવી અનોખા ઇતિહાસનું સર્જન કરે અને સમગ્ર કડવા પાટીદાર સમાજનું પ્રેરક પ્રતિબિંબ બની રહે એવા ઉદ્દેશ્યોથી પ્રેરાઇને શ્રી ઘડુલી પાટીદાર સમાજે કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓ, વડીલો તથા દરેક વિભાગમાંથી યુવાનોને આમંત્રણઆપી તા. ૧-૧૨-૧૩ના નડીયાદ મુકામે મીટીંગનું આયોજન કરેલ. જેમાં ભારતભરમાં રહેતા ઘડુલી સમાજના યુવાનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપેલ. પધારેલ વડીલો અને યુવાનોએ પોતાના વિચારો રજૂ કરેલ. ચર્ચા વિચારણાના અંતે આપણી ઘડુલી સમાજના યુવાધનને સંગઠીત કરવા અને તેઓને એક છત્ર નીચે લાવી તેમનું અખિલ ભારતીય લેવલે યુવક મંડળ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ અને યુવક મંડળનું પ્રથમ મહામિલન "યુથ યુનિટી ફોર ઘડુલી-૨૦૧૪" ઘડુલી ખાતે તા. ૯-૩-૧૪, રવિવારના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ. ઉપરોક્ત મહામિલનનું આયોજન કરવા માટે ૧૩ સભ્યોની એડહોક કમિટીની રચના કરવામાં આવેલ છે.

એડહોક કમિટીની મિટીંગ તા. ૨૧-૧૨-૧૩, શનિવારના રોજ નડીયાદ મધ્યે મળેલ. જેમાં તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ બનાવેલ યુવક મંડળના બંધારણની રજૂઆત કરવામાં આવેલ. જેમાં ઉચિત સુધારા-વધારા કર્યા બાદ બંધારણને આખરી ઓપ આપવામાં આવેલ. ત્યારબાદ તા. ૯-૩-૧૪ના રોજ યોજનાર મહામિલનના કાર્યક્રમની ચર્ચા વિચારણા કરવામાં આવેલ. ચર્ચા વચારણાના અંતે નીચે મુજબના કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ.

તા. ૯-૩-૧૪ અને ૧૦-૩-૧૪ના બે દિવસનો કાર્યક્રમ રાખવો. જેમાં પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં યુવકોનું સ્વાગત કર્યા બાદ બંધારણને માન્યતા આપવી, બપોર પછીના સત્રમાં પધારેલ યુવાનોના વિચારો લેવા, ત્યારબાદ યુવક મંડળની રચના કરવી. રાત્રે હાસ્ય રસનો કાર્યક્રમ રાખવાનું નક્કી કરવામાં આવેલ.

તા. ૧૦-૩-૧૪ના બસો દ્વારા તથા પ્રાઇવેટ વાહનો દ્વારા એક દિવસીય કચ્છ દર્શનનું આયોજન કરવું. બહારગામથી આવનાર યુવાનો તા. ૮-૩-૧૪ના સાંજ સુધી ઘડુલી ખાતે આવી જાય તે ધ્યાનમાં લેવું. આયોજનની વ્યવસ્થા માટે નીચે મુજબની સમિતિઓ બનાવવામાં આવેલ છે. (૧) રજીસ્ટ્રેશન (ઓફિસ) સમિતિ (૨) ઉતારા સમિતિ (૩) રસોડા સમિતિ (૪) સ્ટેજ, મંડપ, લાઇટ-માઇક સમિતિ અને (૫) પ્રવાસ સમિતિ

ત્યારબાદ તા. ૧૫-૧-૧૪ના રોજ નડીયાદ મધ્યે એડહોક કમિટી તથા દરેક વિભાગમાંથી પધારેલ યુવાન પ્રતિનિધિઓની મીટીંગ મળેલ. મીટીંગમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવેલ. દરેક વિભાગમાંથી કેટલા યુવકો આવશે તેનાં આવેલ ફોર્મની સમીક્ષા કરવામાં આવેલ. બહારગામથી લગભગ ૪૪૮ યુવકો આ પ્રથમ મહામિલનમાં હાજરી આપશે તથા સ્થાનિક રહેતા યુવકો પણ હાજર રહેશે. આમ અંદાજે ૫૦૦ યુવકો મીટીંગમાં હાજરી આપશે. તે સિવાય સમાજની કારોબારી સમિતિ તથા મહિલા મંડળના સભ્યો પણ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n16/mode/1up

realpatidar.com

હાજર રહેશે. સમાજની સ્થાપનાના પાયાના પથ્થર અને સમાજ માટે પોતાનું વિશિષ્ઠ યોગદાન આપનાર વડીલો તથા આગેવાનોને પણ આ ઐતિહાસિક મીલનમાં હાજર રહેવા આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવેલ. સમાજ દ્વારા યોજાનાર આ આયોજનના ખર્ચને પહોંચી વળવા દાતાઓ લેવાનું નક્કી કરવામાં આવેલ. જેમાં મીટીંગમાં જ અમુક દાતાઓએ સ્વૈચ્છીક નામો નોંધાવેલ. તે સિવાય જે દાતાઓને ઇચ્છા હોય તે આ ઐતિહાસિક મિલનના ખર્ચના દાતા તરીકે સ્વૈચ્છીક નામો પાછળથી પણ નોંધાવી શકશે. અત્યાર સુધી નોંધાયેલ દાતાઓ તથા બાકી રહેલ દાતાઓની વિગત નીચે મુજબ છે. (૧) ભોજન દાતા : તા. ૮-૩-૧૪ : બપોરના - રૂા. ૧૦,૦૦૦/- શ્રી સામજીભાઇ વાલજી સાંખલા-નડીયાદ. તા. ૮-૩-૧૪ - સાંજે : રૂા. ૨૫,૦૦૦/- શ્રીમતી લક્ષ્મીબેન દેવશીભાઇ સાંખલા-થાણા-મુંબઇ, તા. ૯-૩-૧૪ : પુરા દિવસના દાતા : રૂા. ૮૧,૦૦૦/- લાલજીભાઇ દેવજીભાઇ ચૌધરી-ચાણસ્મા, તા. ૧૦-૩-૧૪ - સવારના : રૂા. ૧૦,૦૦૦/- દાતાનું નામ બાકી, તા. ૧૦-૩-૧૪ - સાંજે : રૂા. ૨૦,૦૦૦/- દાતાનું નામ આવવાનું બાકી. (૨) કચ્છ દર્શનના દાતા : તા. ૧૦-૩-૧૪ : રૂા. ૮૦,૦૦૦/- દાતાનું નામ બાકી. (૩) પેન તથા પેડના દાતા : રૂા. ૧૫,૦૦૦/- શ્રી લખુભાઇ કેશરાભાઇ માંકાણી-બોરસદ (૪) મનોરંજન (હાસ્યરસ) કાર્યક્રમના દાતા : તા. ૧૦-૩-૧૪ રાત્રે : રૂા. ૨૦,૦૦૦/ - શ્રી કાન્તીલાલ લખમશીભાઇ લીંબાણી-થાણા-મુંબઇ. (૫) રાત્રે ચા-નાસ્તાના દાતા : રૂા ૧૦,૦૦૦/ - શ્રી કાન્તીલાલ લખમશી લીંબાણી-થાણા-મુંબઇ. (૬) સભા મંડળના દાતા : રૂા. ૫૦,૦૦૦/- (૧૦,૦૦૦/-ના હિસાબે પાંચ દાતા લેવા) (૧) રૂા. ૧૦,૦૦૦/- સ્વ. ખીમજીભાઇ વેલજીભાઇ નાંકરાણી-ખોપોલી-મુંબઇ. (૨) રૂા. ૧૦,૦૦૦/- સ્વ. હરજી રણમલ રૂડાણી-ખોપોલી-થાણા-મુંબઇ. ત્રણ દાતાઓના નામ આવવાનાં બાકી છે. ત્યાર બાદ દરેક યુવાનો જયારે સભામંડપમાં પધારશે ત્યારે ગેટ ઉપર તેમનું કુમારીકાઓના હસ્તે કંકુ-ચોખાથી તિલક કરવામાં આવશે. સભામાં પધારનાર દરેક ઝોનના કન્વીનરને વિનંતી કરવામાં આવે છે કે તેઓએ ફોર્મમાં યુવકોના નામો લખેલ છે તેમની આજીવન સભ્ય ફી રૂા. ૨૫૦/- સાથે લતા આવે, સભ્યનું નામ, એડ્રેસ, ઉંમર તથા ગામ અને મોબાઇલ નંબરની માહિતી પણ સાથે લેતા આવે.

શ્રી ઘડુલી પાટીદાર સમાજના સર્વે સભ્યોને જાણ કરવામાં આવે છે કે સમાજ દ્વારા આયોજીત આ કાર્યક્રમથી આપણા યુવાન દીકરાઓને ખૂબ જ ફાયદો થશે એવો અમોને વિશ્વાસ છે. કારણ કે સમયની સાથે પરિવર્તન જરૂરી છે. આ મિલનથી ભારતભરમાં રહેતા આપણી સમાજના યુવકો એક મંચ પર આવશે, જેનાથી ઓળખાણો વધશે, સમાજ વિકાસના વિચારો સાથે ધંધાકીય વિચારોનું પણ આદાન પ્રદાન થશે, સમાજ સંગઠનના નવા અને આધુનિક વિચારો મળશે, જેનાથી સમાજને ભવિષયનું નેતૃત્વ મળશે અને સમાજની તથા યુવકોની ભવિષ્યની ઉજ્જળ કારકિર્દીનું નિર્માણ થશે અને તંદુરસ્ત અને આધુનિક સમાજનું નિર્માણ થઇ શકશે. આપણે વડીલોની પણ ફરજ બની રહે છે કે આપણે આપણા દીકરાઓને આપણી સંસ્કૃતિ તથા વડીલોના વિચારોના વારસાનું જ્ઞાન કરાવીએ.

તા. ૧૬-૧-૧૪ના ઘડુલી ખાતે સ્થાનિક રહેતા યુવકો તથા વડીલોની મીટીંગ બોલાવેલ. ઉપસ્થિત દરેકને સમાજની અત્યાર સુધીની થયેલ મીટીંગનો અહેવાલ આપેલ અને યુવકોના વિચારો લીધેલ. એડહોક કમિટીએ બનાવેલ સમિતિઓનું વાચન કરવામાં આવેલ અને તેમાં ઉપસ્થિત યુવકો તથા વડીલોનાં નામો નોંધવામાં આવેલ અને સૌને જવાબદારી સોંપવામાં આવેલ.

વધારે માહિતી માટે નીચે મુજબના નંબરો પર સંપર્ક કરવા વિનંતી. (૧) કાન્તીભાઇ લીંબાણી - ૦૯૮૨૧૭ ૫૧૧૧૧, (૨) વસંતભાઇ સાંખલા - ૦૯૮૨૫૪ ૮૫૦૦૦, (૩) મોહનભાઇ રૂડાણી - ૦૯૯૮૭૧ ૧૩૬૩૬, (૪) અમૃતભાઇ માંકાણી - ૦૯૮૨૫૪ ૬૭૭૭૧

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n17/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

સાબર રીજીયન દ્વારા 'યુવા સુરક્ષા કવચ' સદ્ભાવના કાર્યક્રમ અંતર્ગત સદ્ગતના પરિવારને સમાજના વડીલોના હસ્તે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો

શ્રી અ.ભા.ક.ક.પા. યુવાસંઘના સાબર રીજીયને વધુ એક ઉમદા કાર્ય દ્વારા સારાયે દેશમાં નંબર-૧ રીજીયન હોવાની સાથે સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા લોક હૃદયમાં પણ નંબર-૧નું સ્થાન પ્રાપ્ત કરી ડૉ. વસંત ધોળુની ટીમે યશ કલગીમાં એક વધુ પીંછું ઉમેર્યું છે. યુવાસંઘ દ્વારા ચાલતી 'યુવા સુરક્ષા કવચ' (વાય.એસ.કે.) યોજના આજે ખરેખર છેક છેવાડાના પરિવારને સમાજના વર્તમાન પ્રવાહમાં જોડી શકે છે તેનો આનંદ અને કંઇક આપીને, ઘસાઇને ઉજળા થવાની ભાવના સાથે આજે કેટલાય સમાજજનોના અંતરના આશીર્વાદ યુવાસંઘ સાબર રીજીયનના દરેક કાર્યકર્તાઓના મુખ પર જોવા મળ્યા.

પ્રસંગ હતો ઇડર ડીવીઝનના કંપામાં વસતા એકમાત્ર સનાતની પરિવારમાં આ યોજનાના સભ્ય એવા ભાનુબેન પરસોત્તમભાઇ ઠાકરાણીના તા. ૬ જાન્યુઆરીના રોજ થયેલ દુઃખદ અવસાનનો. તેમના અવસાનની જાણ થતા તુરંત જ એજ રાત્રે ઇડર ખાતે તે વિભાગના યુવાસંઘ અને સમાજના કાર્યકર્તાઓની સાથે રીજીયન વતી ડૉ. વસંત ધોળુ, જીતેન્દ્ર દીવાણી, ભરત સુરાણી, દિલીપ ધોળુ, હરી રૂડાણી (ચેન્નાઇ)ની ટીમે રૂબરૂ મુલાકાત કરી અને મૃત્યુ બાબતે વિગતે તપાસ કરી અને યોજનાના નિયમોની વિગતે ચર્ચા કરી મૃતકના ડૉક્ટરી રીપોર્ટ સનાતન મેડીકોઝના ડૉ. અમૃતભાઇ ધોળુને આપ્યા અને ચકાસણી બાદ (કારણ કે અપમૃત્યુ અને એક વર્ષથી ઓછી ગંભીર બીમારીના કિસ્સામાં લાભ આપી શકાતો નથી, કારણ યોજનાનો મૂળભૂત હેતુ ફક્ત લાભ લેવાનો નહીં પરંતુ ૧૮ થી ૫૫ વર્ષના કોઇપણ સનાતની યુવક કે યુવતીને મૃત્યુ દીઠ રૂા. ૭૦, ૯૦, ૧૧૦ કે ૧૩૦ જેવી નાનકડી રકમ દ્વારા સહયોગી થઇ મોટાભાઇની ભૂમિકા નિભાવવા અને 'અપને લિયે નહીં... લેકિન અપનો કે લિયે'નો ભાવ છુપાયેલ છે.) આ પરિવારને યુવા સુરક્ષા કવચ યોજના થકી રૂા. બે લાખ આપવાની ખાતરી આપી.

તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ યુવાસંઘ સાબર રીજીયનની સમગ્ર ટીમ, ઉત્તર અને દક્ષિણ સાબરકાંઠા ઝોન સમાજ વતી નરસિંહભાઇ રામાણી, પુનમભાઇ ધોળુ, અરવલ્લી અને અમીરગઢ વિભાગીય સમાજના હોદ્દેદારો, સમાજના વડીલો અને યુવાઓ બપોરે ૨-૩૦ કલાકે સદગતના નિવાસસ્થાને બેસણામાં હાજર રહ્યા અને દિલાસો તથા સદ્ભાવના વ્યકત કરી વડીલોના હાથે યુવા સુરક્ષા કવચ યોજના (વાય.એસ.કે.)નો રૂા. એક લાખનો ચેક અર્પણ કર્યો. ત્યાર બાદ બપોરે ૩-૩૦ કલાકે જમરેલા કંપા ખાતે ઇડર ડીવીઝન પ્રમુખ ધીમંતભાઇ પોકાર, મંત્રી કિરીટભાઇ પોકાર, અલ્પેશ રામાણી અને યુવા મંડળના અરવિંદભાઇ પટેલ તથા સભ્યો દ્વારા સદભાવના કાર્યક્રમનું આયોજન રીજીયન ચેરમેન ડૉ. વસંત ધોળુની અધ્યક્ષતામાં કરવામાં આવેલ.

યુવાસંઘ સાબર રીજીયન દ્વારા યુવા રમતોત્સવનું ભવ્ય આયોજન

શ્રી અ.ભા.ક.ક.પા. યુવાસંઘ વર્ષ ૨૦૧૩ના શ્રેષ્ઠ રીજીયન એવા સાબર રીજીયન દ્વારા યુવા ભાઇઓ-બહેનોમાં રહેલ આંતરિક શકિત ખીલવવા અને સનાતની ભાઇચારો વધુ ગાઢ બનાવવાના હેતુસર સાબર સ્ટેડીયમ, હિંમતનગર ખાતે તા. ૨૫ ડીસેમ્બર ૨૦૧૩ના સ્વામી વિવેકાનંદ યુવા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. ગુજરાત સરકારના ખેલ મહાકુંભના નિયમો મુજબ દોડ, કૂદ, ફેંક, ટેબલ ટેનીસ, બેડમિન્ટન,

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n18/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

સ્વીમીંગ, ચેસ, ટેકવોન્ડો, સ્કેટિંગ, શીઘ્ર ચિત્ર અને રસ્સા ખેંચ જેવી વિવિધ ૧૫ જેટલી રમતો ચાર ગ્રુપમાં અંડર-૧૨, અંડર-૧૬, અંડર-૨૦ અને ઓપન ભાઇઓ-બહેનો અલાયદા વિભાગમાં યોજવામાં આવી હતી. ૭થી લઇ ૭૫ વર્ષ સુધીના અબાલ વૃધ્ધ મળી કુલ ૪૦૦ ઉપરાંત રમતવીરોએ વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય દર્શાવેલ. સવારના ૮-૩૦ કલાકે સાબર રીજીયન ચેરમેન ડૉ. વસંત ધોળુની અધ્યક્ષતામાં યોજાયેલ ઉદ્દ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય સમાજના દક્ષિણ સાબરકાંઠા ઝોનના પ્રમુખ પૂનમભાઇ ધોળુ, ઉત્તર સાબરકાંઠા ઝોનના કાન્તીભાઇ પોકાર, રસિકભાઇ છાભૈયા, હિંમતનગર વિભાગીય સમાજના પ્રમુખ દેવશીભાઇ પટેલ, હિંમતનગર સનાતન સમાજના પ્રમુખ ડૉ. ભીમજીભાઇ પટેલ, સનાતન મેડીકોઝ વતી ડૉ. અમૃતભાઇ ધોળુ અને ડૉ. સી.ડી. પટેલ, લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ નવીનભાંઇ ગોરાણી તથા જેઠાભાઇ હળપાણી, પ્રવીણભાઇ ચોપડા, ભાઇલાલભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય યુવાસંઘ વતી પી.આર.ઓ. અશોક ભાવાણી, કિરીટ પોકાર, રાહુલ દીવાણી અને રાજુ સુરાણી તથા સાબર રીજીયનના ઉપપ્રમુખ ભરત સુરાણી, મહામંત્રી જીતેન્દ્ર દીવાણી, દિલીપ ધોળુ અને હિંમતનગર ડીવીઝન અને તેના યુવામંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સર્વેએ ખેલાડીઓને પૂરા ઝોમ-જુસ્સા સાથે ખેલદિલી પૂર્વક રમવા અને પ્રતિ વર્ષે ૨૫ ડીસેમ્બરના રોજ રમતોત્સવનું આયોજન કરવા જણાવેલ.

સર્વે મહેમાનોએ ૧૦૦ મી. દોડની રેસમાં ભાગ લઇ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સાબરકાંઠાના નવનિર્મિત સાબર સ્ટેડીયમ સ્વર્ણિમના સથવારેની રમઝટ અને ડી.જે.ના તાલે આખોય દિવસ ગુંજતું રહ્યું હતું. કયાંક શાંતિપૂર્ણ ચેસની ટક્કર તો કયાંક ચિચિયારીઓ ભરેલ દોડ અને ગોળા ફેંક તો ક્યાંક તાળીઓના ગડગડાટ સાથેની સ્કેટિંગ અને ટકાટકવાળી ટેબલ ટેનીસે લોકોના દિલ જીતી લીધા હતા. સૌથી વધુ સ્પર્ધકો મુખ્યત્વે તખતગઢ, ગાંધીપુરા, તારંગા, ઇડર, હિંમતનગર અને રણજીતપુરાથી હતા. અંતમાં સાંજના ચાર કલાકે રસ્સા ખેંચ શરૂ થઇ. જેમાં બધા વિભાગોમાં જોરદાર કશ્મકશ રહી. ખાસ કરીને બહેનો તથા વડીલોના વિભાગમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો.

અંતમાં ભાગ લેનાર દરેકને સર્ટીફિકેટ અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા સર્ટીફિકેટ એનાયત કરવામાં આવેલ. આ કાર્યક્રમના આયોજનમાં તખતગઢના નિલેશ ભોજાણી, દશરથભાઇ ધોળુ, કિરીટભાઇ, જીતેન્દ્ર પોકાર તથા યુવા મંડળના સભ્યો અને ભરત ભાવાણી (મોતેસરી), અલ્પેશ રામાણી (ઇડર), રાહુલ દીવાણી (રણજીતપુરા), હિંમતનગર સનાતન યુવા મંડળ, ગાંધીપુરા સનાતન યુવા મંડળના સભ્યોએ સરાહનીય ભૂમિકા ભજવેલ. ભોજન અને મંડપ વ્યવસ્થા મહેન્દ્ર હલપાની અને મિત્રોએ નિભાવેલ.

યુવાસંઘ સાબર રીજીયન દ્વારા રાજકોટ ખાતે ઉદ્યોગ દર્શન પ્રવાસનું આયોજન

શ્રી અ.ભા.ક.ક.પા. યુવાસંઘના સાબર રીજીયન દ્વારા ગ્રામ્ય કક્ષાએ વસતા યુવા ભાઇઓ માટે પોતીકા વારસાગત વ્યવસાય ખેતી, સો મિલ કે કન્સ્ટ્રકશન સિવાયના નવા લઘુ ઉદ્યોગોની રૂબરૂ મુલાકાત માટેનો એક અનોખો કાર્યક્રમ રાજકોટ ખાતે આયોજિત કરેલ. મહાત્મા ગાંધી રીજીયનના ઉપપ્રમુખ મનસુખભાઇ પટેલ તથા રાજકોટ યુવા મંડળ અને કેન્દ્રીય યુવાસંઘના પૂર્વ પ્રમુખ ભરતભાઇ પોકાર તથા બીઝનેશ કન્વીનર ધીરજ ડાયાણીના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ. સાબર રીજીયનમાં મોટેભાગે ખેતી અને તેને સંલગ્ન નાના મોટા વ્યવસાયો ચાલી રહે છે. યુવાધન આ પોતીકા વ્યવસાય સિવાય

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 17 of 40
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n19/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

નવા ક્ષેત્ર તરફ વિચારતું થાય તે હેતુસર રીજીયન ચેરમેન ડૉ. વસંત ધોળુ અને તેમની ટીમ દ્વારા આ પ્રકારના વધુ પ્રયાસો કરી સમાજના મિશન ૨૦૨૦ ને સફળ બનાવવા અડગ નિર્ધાર કરેલ છે. ગ્રામ્ય કક્ષાએ ઓટલા પર બેસી દેશ દુનિયાની ચર્ચા કરતા યુવાઓમાં રહેલ કોઠા સૂઝ અને આંતરિક શક્તિ ખીલવવા અને સનાતની ભાઇચારો વધુ ગાઢ બનાવી તેમનામાં બીઝનેશના કૌશલ્યો ઉજાગર કરવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

રાજકોટએ ગુજરાતની વિકસિત ઉદ્યોગ નગરી છે. જ્યાં મોટે ભાગે મશીનરી અને અન્ય નાના ઓછી જગ્યા અને ઓછા મૂડી રોકાણથી શરૂ કરી શકાય તેવા અનેક ઉદ્યોગો ચાલી રહેલ છે. બે દિવસના આ ઉદ્યોગ દર્શનમાં ૨૮ યુવાઓ સામેલ થયેલ હતા. વિઝીટ દરમ્યાન ગૃપ ડિસ્કશન, ઉદ્યોગો શરૂ કરવાની પ્રાથમિક માહિતી, રોકાણ, ઉત્પાદન, રો-મટેરિયલ, જરૂરી સ્ટાફ, માર્કેટીંગની માહિતી સાથે સાથે તેમના માટે બીઝનેસ મેનની જેમ જ હોટેલમાં ઉતારો, કીટ, ભોજન, ટ્રાન્સ-પોર્ટેશનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ. ઇમિટેશન જવેલરી, નટ-બોલ્ટ, નેનો કાર સ્પેર પાર્ટ્સ, સ્ટવ, હાર્ડવેર પાર્ટ્સ, મશીનરી, પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ જેવા વિવિધ ૧૮થી વધુ લઘુ ઉદ્યોગોની મુલાકાત લઇ સાબરના યુવાઓ નવા વિચાર સાથે પરત ફર્યા હતા.

આગામી સમયમાં અમદાવાદ, અંકલેશ્વર, સુરત ખાતે આજ પ્રકારના વધુ ઉદ્યોગ દર્શનના આયોજનો વિચારાધીન છે. સાબર રીજીયન વતી બીઝનેલ લીડર હરેશ પોકાર (હિંમતનગર)ની આગેવાનોમાં અને યુવાસંઘ હોદ્દેદાર કિરીટ પોકાર (તલોદ), રાજુ સુરાણી (મોડાસા), દિલીપ ધોળુ (હિંમતનગર), હિતેશ પટેલ (અમીરગઢ), રાજુ રૂશાત (તલોદ) પણ ટીમ સાથે જોડાયેલ.

યુવાસંઘ સાબર રીજીયન દ્વારા વડીલ વિમાન પ્રવાસનું આયોજન

કુળદેવી મા ઉમા અને ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદથી આપણે આર્થિક રીતે સમૃદ્ધ થયા છીએ. ધંધાના વિકાસને લીધે દેશ-વિદેશમાં આવન-જાવન દરમ્યાન દુનિયાની બધીજ ભૌતિક સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણા વડીલો કે જેઓએ વિમાનને કદાચ આકાશમાં ઉડતા જોયું હશે, તેઓએ મોટે ભાટે ટ્રેનના સ્લીપર કોચમાં કે સાદી બસમાં જ મુસાફરી કરી કચ્છથી પરદેશમાં અને કંપાઓમાં જમીનો અને સો મિલો વિકસાવી આપણને વારસામાં સંસ્કારની સાથે સાથે અમૂલ્ય સંપત્તિ અને વૈભવ પણ આપે, છતાં આ વડીલો હાલમાં પણ સાદાઇથી પોતાનું જીવન વિતાવી રહ્યાછે. આવા પૂજનીય વડીલો માટે યુવાસંઘના સાબર રીજીયન દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે સાથે માતૃ-પિતૃ ઋણ અદા કરવા માટે એક અનોખા વડીલ વિમાન પ્રવાસનું આયોજન આગામી માર્ચમાં કચ્છ અને ઉત્તર ભારત રીજીયનના સહયોગથી કરેલ છે.

આ પ્રવાસમાં વડીલો અમદાવાદથી ફ્લાઇટ (વિમાન) દ્વારા દિલ્હી પહોંચશે. જયાંથી તેઓ એ.સી. વોલ્વો બસ દ્વારા દિલ્હી દર્શન, ગોકુળ, મથુરા, વૃંદાવન, આગ્રા અને મેટ્રો ટ્રેનની સફર કરશે. જયાંથી એ.સી. ચેર કાર દ્વારા અમૃતસર, વાઘા-અટારી બોર્ડર પર ભારત-પાક મીલેટરી માર્ચ પાસ્ટનાં નજારો નિહાળશે. થ્રી સ્ટાર હોટેલ ઇશાન વીલામાં રાત્રી રોકાણ કરી, જલિયાવાલા બાગ, સુવર્ણ મંદિરની મુલાકાત પણ લેશે. એસી ટ્રેન દ્વારા હરદ્વાર અને છેલ્લે ઊંઝાથી માઁ ઉમાના આશીર્વાદ સાથે આ પ્રવાસણી પૂર્ણાહૂતિ થશે. આ પ્રવાસમાં ૩૯ વડીલો સાથે યુવાસંઘના ત્રણ સભ્યો લક્ષ્મીનારાયણ સ્વરૂપે સેવા કાર્ય માટે સાથે રહેશે. પ્રથમ પ્રવાસ ૫ માર્ચના રોજ રવાના થશે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n20/mode/1up

realpatidar.com

શ્રી ક.ક.પા. યુવક મંડળ-શહાડ, કોન, કલ્યાણ અને ઉલ્હાસનગર દ્વારા

'ઉમા કપ-૨૦૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટ'નું થયેલ ભવ્ય આયોજન

સુરેશ અબજી જાદવાણી

શ્રી ક.ક.પા. યુવક મંડળ-શહાડ, કોન, કલ્યાણ, ઉલ્હાસનગર દ્વારા 'ઉમા કપ-૨૦૧૪' ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. ૧૯/૧/૧૪ને રવિવારના ઓ.એફ.એ. ગ્રાઉન્ડ, અંબરનાથ ખાતે કરવામાં આવેલ. સર્વપ્રથમ સવારે ૮-૦૦ કલાકે ભોજનના દાતાશ્રીઓ માવાણી ટીમ્બર માર્ગ, ઉમિયા ટીમ્ર માર્ટ (શહાડ), જે.કે. ટીમ્બર માર્ટ-કોન, શિવ ટીમ્બર માર્ગ-ઉ.નગર, ભવાની ટીમ્બર માર્ટ-કોનના ભાઇઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ચારેય ટીમને લાઇનબધ્ધ ઉભી રાખીને માઁ ઉમાનો જયઘોષ કરવામાં આવેલ. ત્યારબાદ પીચ ઉપર દાતાશ્રીઓના વરદ્હસ્તે શ્રીફળ વધેરીને આઠ ઓવરની છ લીગ મેચ અને ફાઇનલ મેચ એક કુલ ૭ મેચ રમાડવામાં આવેલ. ટુર્નામેન્ટની પ્રથમ મેચ કોન વિરુધ્ધ ઉલ્હાસનગર હતી. કોનના બોલર હરેશ ચુનીલાલ છાભૈયાએ ઉલ્હાસનગરને બે ઓવરમાં માત્ર સાત રન આપી ૭ વિકેટ ખંખેરી મેચને કાબુમાં રાખેલ. ફાઇનલ મેચ એક દિલધડક મેચ રહેલ જેમાં શહાડ વિરુધ્ધ કલ્યાણ હોઇ કલ્યાણ ઇલેવનની ટીમે નિર્ધારિક આઠ ઓવરમાં ૫૮ ૮ વિકેટના ભોગે કરેલ. તેની સામે શહાડ ઇલેવનની ટીમે સારી લડત આપેલ પરંતુ સંજોગોવસાત શહાડની ટીમ માત્ર ૫૬ રનમાં ઓલઆઉટ થઇ ગયેલ અને કલ્યાણની ટીમે એક બોલ બાકી રહેતા માત્ર બે રને વિજય હાંસલ કરેલ. મેચની અંતિમ ક્ષણ સુધી દિલધડક મેચની સર્વએ મોજ માણેલ. ટુર્નામેન્ટમાં દાતાશ્રીઓએ મન મૂકીને પોતાનું અમૂલ્ય ફાળો નોંધાવેલ. એવમ્ સ્વેચ્છા દાતાએ પણ પોતાનો બહુમૂલ્ય ફાળો આપી ટુર્નામેન્ટને સફળ બનાવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટમાં મુંબઇ યુવક મંડળના પ્રમખુશ્રી હિતેશભાઇ રામજીયાણી એવમ્ ટીમ ડોમ્બીવલી યુવક મંડળ, ભિવંડી યુવક મંડળ વગેરેથી મહાનુભાવો પધારીને ટુર્નામેન્ટને ચાર ચાંદ લગાવી દીધેલ અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ. આ ઉપરાંત ચારેય મંડળ અને સમાજમાંથી બાળ-ગોપાલ,વડીલો અને બહોળી સંખ્યામાં માતા-બહેનો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડેલ.

ટુર્નામેન્ટના સર્વ શ્રેષ્ઠ ખેલાડીઓને ઇનામોથી નવાજમાં આવ્યા હતા. મેન ઓફ ધી મેચ (ફાઇનલ) : શ્રી મનિષ કાંતિલાલ લિંબાણી (કલ્યાણ), મેન ઓફ ધી સિરીઝ : શ્રી મનિષભાઇ કાંતિલાલ લિંબાણી (કલ્યાણ), બેસ્ટ બેટ્સમેન : શ્રી ચેતન બાબુલાલ નાકરાણી (શહાડ), બેસ્ટ બોલર : શ્રી હરેશ ચુનીભાઇ છાભૈયા (કોન), બેસ્ટ ફિલ્ડર : શ્રી અશોક નારણભાઇ લિંબાણી (કલ્યાણ)

મેચો પૂર્ણ થયા બાદ ચારેય સમાજના વડીલો એવમ્ દાતાશ્રીઓને પુષ્પગુચ્છના સન્માન સાથે મંચસ્થ કરાવેલ. વડીલોએ પોતાના મંતવ્યો આપેલ. ટુર્નામેન્ટમાં ૬૦૦થી ઉપર સભ્યોએ હાજરી આપી ટુર્નામેન્ટને નિહાળેલ. આમ 'ઉમા કપ-૨૦૧૪' ટોટલ ૧૦મી ટુર્નામેન્ટને દાતાશ્રીઓના બહુમૂલ્ય યોગદાન, વડીલો-માતાઓના અમી આશિર્વાદ, વિવિધ સમિતિઓના ખભે-ખભા મિલાવી સમાજ સહાકાર રૂપી ઉમદા કાર્ય અને ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં પ્રોત્સાહિત દર્શકોથી એવમ્ મોજ અપાવનાર ખેલાડીઓ તેમજ પધારેલ મહાનુભવો-મહેમાનોના સથવારે ટુર્નામેન્ટ ખૂબ જ આનંદ-ઉમંગથી પાર પડેલ.

ટુર્નામેન્ટમાં માઇક સંચાલન શ્રી સુરેશ અબજી જાદવાણી એ કરેલ અને આભારવિધી શ્રી નરશી ખીમજીભાઇ પોકારે કરેલ. અંતે રાષ્ટ્રગીત ગાઇને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે બપોર અને રાત્રે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. રાત્રે ૯-૦૦ કલાકે સર્વ ભોજન કરીને છૂટા પડેલ.

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n21/mode/1up

realpatidar.com

કચ્છમાં કણબીનો વિસ્તાર...

સતપંથને કારણે...

(કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ માંથી સાભાર)

ગામ અંગીઆ-ચોપડા : મૂળ પુરુષ દેવજી પટેલ ઊંઝામાં રહેતા. ત્યાંથી મેળામાં ગીરમથા ગયા અને પીરનો ધર્મ પાળ્યો તેથી શીકરું ગયા. ત્યાંથી કેટલાંક વર્ષ પછી તેમનો પુત્ર જસોજી સં. ૧૭૮૬માં અંગીઆ ગામે આવી વસ્યો.

ગામ કોટડા-છ ભઇયા (છાભૈયા) : આ કણબીઓ અસલ અમદાવાદના વાસી હતા. પરંતુ વીરમથા ગયા અને પીરાણાનો પંથ સ્વીકારવાથી સં. ૧૭૬૫માં ગામ શીકરું આવ્યા. પછી ત્યાંથી કેટલાકં વર્ષો પછી દૂધઇ ગયા. ત્યાંથી પણ સં. ૧૮૨૩માં માધો પટેલ તથા જીવો પટેલ કોટડા આવી વસ્યા. તેઓની અસલ શાખ પારેખની હતી; પરંતુ છ ભાઇઓનો વંશ અને એક પુત્રથી જ છ પેઢી સુધી ચાલ્યો તેથી તેઓ છ ભઇયા કહેવાય છે.

ગામ નખત્રણા-પોકાર : એમના અસલ પુરુષો મહેસાણામાં રહેતા. ત્યાંથી નીકળી કાનમમાં આવ્યા. સં. ૧૭૧૯માં પીરનો ધર્મ પાળ્યો, એટલે પુંજો પટેલ શીકરું આવી વસ્યા. પછી ત્યાંથી દૂધઇ આવ્યા અને ત્યાંથી પણ અબજી, જસો અને હરજી પટેલ એ ત્રણ ભાઇઓ સં. ૧૮૨૮માં નખત્રાણા આવી રહ્યા.

ગામ નખત્રાણા-રામાણી : એમના પૂર્વજો મૂળ ભાલેજ (આંણદ પાસે)થી સં. ૧૫૯૨ના કાતરક સુદ-૨ના રોજ પીરના ધર્મમાં આવ્યા અને ગુજરાત છોડી શીકરું ગામે વસ્યા. કેટલાક તેમના વંશજો નખત્રાણા આવ્યા. તેમાંના કેશરાના વંશનો ખેતો, તેનો નારાયણ, તેનો ગોપાલ કે જે રામાણી તે જેરાજ લીંબાણીની પુત્રી સાથે પરણ્યો. તેમનો વંશ હજુ નખત્રાણામાં છે.

ગામ નેત્રા-સાંખલા : તેઓ અસલ ઊંઝામાં રહેતા. પછી ત્યાંથી આણંદ ગયા અને પટેલાઇ કરી. તેમાંથી એક પુરુષ માળવા, એક નારદીપુર (કલોલ તાલુકો) અને એક શીકરું જઇ રહ્યા. તેમના વંશજ માણેકવાડા અને ત્યાંથી બઢારમોર આવ્યા. વાસણનો વંશ ભાદરણ (તા. આણંદ) ગયો અને તેના બીજા પિત્રાઇ બાવળા (તા. ધોળકા) રહ્યા. અબજીના પુત્ર ધનજી, રતનો અને લાલજી શીકરું ગામેથી નેત્રા આવ્યા. હાલ તેમનો તથા રતનાનો વંશ વેકરા ગયો છે.

ગામ વિથોણ-સુરાણી : એમના વડા સુણાવ (ચરોતર)માં રહેતા. પીરનો ધર્મ સ્વીકારવાથી શીકરું આવવું પડયું. ત્યાંથી તેઓ માનકવા ગયા. ત્યાં ગરાસિયાઓ સાથે લડાઇ થઇ તેમાં ગોપાલ મરાયો, જેની દેરી પશ્ચિમ ભણી હાલ પણ છે, એટલે ગોપાલના પુત્ર મનજી અને વિશરામ સં. ૧૮૦૧માં વિથોણ આવી રહ્યા, જેમનો પરિવાર હાલ પણ ત્યાં વસે છે.

ગામ કરબોઇ-ભાવાણી : અસલમાં વસો (ચરોતર)થી બાવા પટેલ શીકરું આવ્યા. ત્યાંથી કાં કરી તેમના વંશજો માણેકવાડ ગયા. ત્યાંથી તેમનો વંશ ધમડકા ગામે વસ્યો. ત્યાંથી હરજી પટેલનો પરિવાર કરબોઇ આવ્યો અને કૂવો બંધાવ્યો, જ્ઞાતિ જમાડી, બારોટને સં. ૧૮૩૧માં ઘોડીનું દાન આપ્યું અને પટેલાઇ કરી.

ગામ નખત્રાણા-લીંબાણી : એમના ઘરડા અડાલજ (તા. અમદાવાદ)માં રહેતા. ત્યાંથી નડિયાદ ગયો. તેમના વંશજ ગોવા પટેલને જેરાજ, જીવો અને વાસણ નામે ત્રણ પુત્રો હતા. તેમાંથી એક માળવા, બીજો કંબોઇ અને ત્રીજો ગીરમથા ગયો. બીજાએ અને ત્રીજાએ પીરાણાનો ધર્મ અંગીકાર કર્યો, તેથી સં. ૧૭૬૫માં તેઓ શીકરું આવ્યા. જીવાનો પરિવાર રામજી, ધનજી અને ગોરો ત્રણ ભાઇઓએ સં. ૧૭૯૮માં નખત્રાણા આવ્યા. ગોરાનો પુત્ર અણદો, તેનો પેથો, તેનો કેશરો પટેલ અને તેનો

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n22/mode/1up

realpatidar.com

ભોજા પટેલ થયા. ભોજા પટેલ નખત્રાણાથી સં. ૧૯૦૩ની સાલમાં માતૃપક્ષમાં વિરાણી આવી રહ્યા. તેમના રામજી, તેમના નારણજી તથા વાલજી અને વાલજીના જીવરામ તથા વેલજી બે પુત્રો છે.

ગામ મથલ-પોકાર : એમના વડવાઓ નડિયાદમાં રહેતા. ત્યાંથી મગન પટેલ કાનમમાં વસ્યા. ત્યાંથી તેના પુત્ર હંસરાજ અને મોહન ગીરમથા આવ્યા. સં. ૧૭૧૦માં પીરાણાનો ધર્મ લીધો તેથી શીકરું આવી રહ્યાં. ત્યાંથી હંસરાજનો પુત્ર દેવસિંહ તથા મેઘજી સં. ૧૭૪૨ જેઠ વદ-૧૨ના દિવસે મથલ આવ્યા. ત્યાંના ગરાસિયાએ તેમને પટેલાઇ આપી. મેઘલજીનો પુત્ર હરભમ, તેનો શિવજી વગેરે પરિવાર આજે મથલમાં છે.

ગામ ગડાણી-લીંબાણી : મૂળ ઊંઝા ગામે રહેતા. ત્યાંથી બાવળા આવી વસ્યા. ત્યાંથી ગોવિંદ પટેલનો વંશ આણંદ આવ્યો. ત્યાંથી તેના વંશજ અરજણના પુત્રો છગન, હરગોવિંદ અને ગોવિંદ ગામ લાલી (તા. મહેમદાવાદ) આવ્યા અને ત્યાંથી અમદાવાદ આવ્યા. પીરાણાનો પંથ કબૂલ કર્યો તેથી સં. ૧૭૮૨માં કાજી તથા નારણ બંને ભાઇઓ માણેકવાડા આવ્યા. ત્યાંથી ભડલી ગયા અને ત્યાંથી સં. ૧૮૧૩માં કાનજીના વંશજ ખેતો અને અબજી એ બે ભાઇઓ તથા બહેન જસુ અને ભાણેજ નથુ ગડાણી આવી વસ્યા.

ગામ ખોંભડી-પોકાર : અસલ ઘરડાઓ ધોળકા રહેતા હતા. ત્યાંથી પચાણ પટેલ સં. ૧૬૮૩માં ગીરમથા આવ્યા અને પીરનો ધર્મ પાળ્યો. તેથી તેઓ શીકરું આવ્યા. ત્યાંથી વેલાણીમાં વસ્યા. પચાણ પટેલના વાલજી, રતનો અને મેઘજી ત્રણ પુત્રો હતા. તેમનો પરિવાર સં. ૧૭૦૪માં ખોંભડીમાં આવી રહ્યો. મેઘજીનો પુત્ર માધો થયો. તેના અબજી અને પાંચો થયા. પાંચાના પુત્રો મનજી, રામો અને વિશરામ થયા.

ગામ મગવાણા-ચોપડા : અસલમાં તેમના પૂર્વજ નાગજી પટેલ ઊંઝાથી નીકળી સાણંદ વસ્યાં. ત્યાંથી અમદાવાદ આવી પીરનો ધર્મ માન્યો. તેથી સં. ૧૬૭૧માં શીકરું આવ્યાં. ત્યાંથી તેમના વંશજ જસો અને જીવરામ અંગીઆ ગામે આવ્યા. ત્યાંથી સં. ૧૮૧૮માં જીવરાજના પુત્ર ધનજી તથા પૌત્રો ગોરો અને કચરો ગામ મગવાણા આવ્યા અને ત્યાં પટેલાઇ કરી આગેવાન ગણાયા.

ગામ દર્શડી-પોકાર (હાલ બાથાણી) : મૂળ ગામ ધોળકાથી હાલા પટેલ સારંગ ચોહાણ સાથે ગીરમથા ગામે આવ્યા. પીરનો ધર્મ સ્વીકાર્યો તેથી સં. ૧૫૯૮માં શીકરું આવી નાકર તથા વેલા પટેલના કુટુંબમાં રહ્યા. સં. ૧૬૬૪માં હાલાના પુત્રો રામજી તથા જેસિંહ ખેડાઇ આવ્યા. એક ભાઇને નિર્વંશ ગયો. જેસિંહના અરજણ અને દેવસિંહ થયા. દેવસિંહનો પુત્ર મનજી સં. ૧૭૦૪માં માનકવા ગામે વસ્યો. મનજીને રતનો અને લખુ બે પુત્ર થયા. લખુનો પુત્ર અરજી સં. ૧૭૮૪માં દર્શડી આવી વસ્યો અને પટેલાઇ કરી. તેણે ગામમાં પીરાણા ધર્મનું સ્થાનક બાંધી જ્ઞાતિ જમાડી. અબજીને ડુંગર, ગોપાલ, લક્ષ્મણ અને કરશન એમ ચાર પુત્રો થયા. કરસનને પુત્રો સેવજી અને ભાણજી થયા. લક્ષ્મણને પુત્ર વાલજી તથા પુત્રી હીરબાઇ, ગોપાલને બે પુત્ર દેવસિંહ તથા રતના, જ્યારે ડુંગરને પુત્ર ભાણજી તથા બે પુત્રીઓ રતનબાઇ અને માનબાઇ થયાં. એ વગેરે અબજી પોકારનો વંશ છે.

આ પ્રમાણે વિક્રમનાના પંદરમા તથા સોળમા સૈકમામાં આ લોકોએ પોતાનો અસલ હિંદુ ધર્મ બદલી મુસલમાનને ગુરુ કર્યા, તેથી તેમને કુટુંબ જ્ઞાતિ અને ગામ સાથે પણ કલહ થાય તે સ્વાભાવિ હતું. તેથી ધાર્મિક અગવડને લીધે સઘળા પીરાણાપંથી કણબીઓ ક્રમે ક્રમે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાંથી નીકળી વાગડ (કચ્છ)માં શીકરું ગામે આવ્યા; અને ત્યાં પોતાના સહોદર સમાન સ્વધર્મીઓ સાથે મળી જુદી જ્ઞાતિ કરી. કચ્છનો પ્રદેશ વર્ષો થયાં ખેતીવાડીમાં પછાત હતો તેથી ગુજરાતના કાબેલ ખેડૂતો કચ્છના રાવને અનાયાસે મળવાથી, તેણે તેમનો સારો સત્કાર કરી જમીનો આપી. પાછળથી તેથી શીકરુથી સહુ સવડે જુદાં જુદાં ગામોએ જઇ રહ્યા અને આબાદ થયા. **(વધુ પાન-૨૯ ઉપર)**

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n23/mode/1up

realpatidar.com

આત્મ ચિંતન... **પ્રશંસાથી કદીએ હરખાઇ ન જવું અને ટીકાથી વિચલીત ન થવું...**

કારણ વગરની પ્રશંસા સામેની વ્યક્તિ એકાએક કરે ત્યારે સમજવું કે કોઇને કોઇ સ્વાર્થ રહેલો છે..

મનુષ્ય માત્રનો સ્વાભાવ છે કે પોતાની પ્રશંસા સાભંળી ખુશ થઇ જાય છે. પરંતુ પ્રશંસામાં બની શકે તમારા કેટલાક પ્લાસ પોઇન્ટની જ વાત દોહરાવવામાં આવતી હોય છે પણ તમારા માયનસ પોઇન્ટનો બિલકુલ ઉલ્લેખ કરવામાં આવતો ન હોય! એટલે જ તમે તમારી પ્રશંસા સાંભળી ખુશ થઇ જાઓ છો.

પ્રશંસામાં કેટલુંક તથ્ય પણ હોય છે અને માઇનસ પોઇન્ટને નજર અંદાજ કરીને વાતો કરવામાં આવતી હોય છે એ ન ભુવલું જોઇએ!

પંચતંત્રની એક બોધકથા છે. એક કાગડો ક્યાંકથી એક પૂરી લઇ આવ્યો. ચાંચમાં ભરાવીને એક ઝાડની ડાળી ઉપર બેઠો. ત્યારે એક શિયાળ ઝાડ નીચેથી પસાર થઇ રહ્યું હતું. તેની નજર કાગડા ઉપર પડી. તેની ચાંચમાં પૂરી જોઇ શિયાળના મોંમાં પાણી છૂટયું.. તે વિચારવા લાગ્યું કે, કાગડા પાસેથી આ પૂરી કેમ પડાવવી?

શિયાળે એક તરકીબ વિચારી પુછ્યું... કેમ છો કાગડાભાઇ? કાગડો નિરુત્તર રહ્યો. શિયાળ ફરી બોલ્યું... આજ તો તમે કંઇક બોલતા નથી... છો તો મજામાં ને? આટલું બોલી તે કાગડાની પ્રશંસા કરતું બોલ્યું... સાચું પૂછો તો બધા પક્ષીઓમાં તમે મને ખૂબ જ ગમો છો. તમારો બોડી ફિગર તમારો રુપરંગ અને એ બધા કરતાં પણ તમારો અવાજ સાંભળું છું ત્યારે થંભી જાઉં છું. તમે જ્યારે બોલો છો ત્યારે જાણે કોઇ સંગીતના સુર સાંભળી રહ્યો હોઉં એમ હું ડોલવા લાગું છું!!

કાગડો પોતાની પ્રશંસા સાંભળી ખુશ થઇ ગયો. શિયાળે આગળ કહ્યું તમારા અવાજની તોલે કોઇ પક્ષી ન આવી શકે એવો તમારો મધુર અવાજ છે. કાગડો હવે હરખાઇ ગયો અને ખુશીથી ઉછળી પડવાં માંડ્યો... કાં...કાં...કાં...કાં... કરવા જેવી ચાંચ ઉઘાડી, પૂરી નીચે પડી ગઇ, શિયાળભાઇને તો આટલું જ જોઇતું હતું પૂરી લઇને ચાલતી પકડી.

પોતાની પ્રસંશા સાંભળી સૌ કોઇ ખુશ થઇ જાય છે અને જ્યારે ટીકા કરવામાં આવે ત્યારે સામેની વ્યક્તિ પોતાની ટીકા સાંભળી તેને સામેની વ્યક્તિ પ્રતિ નફરત થઇ આવે છે. આ સ્વાભાવિક માનસિકતા છે.

અહિયાં આપણે મુદ્દો લેવાનો છે પ્રશંસા અને ટીકાનો... પ્રશંસામાં રહેલું અસત્ય અને ટીકામાં રહેલા સત્યને ઘણીવાર માણસ નજર અંદાજ કરી દે છે. ક્યારેક પોતાનો હેતુ સિધ્ધ કરવા સાચી વ્યક્તિ આપણી પ્રશંસા કરવા લાગે છે. કારણ વગરની પ્રશંસા સામેની વ્યક્તિ એકાએકા કરવા લાગે... ત્યારે સમજી લેવાનું કે, એને આપણી પાસે કોઇને કોઇ કામ કઢાવવાનો સ્વાર્થ હોય છે! માની લો કે, તમારી કરવામાં આવી રહેલી પ્રશંસામાં થોડું ઘણું તથ્ય પણ હોય.. પરંતુ એકાએક પ્રશંસાના ફૂલ વરસાવવા લાગે ત્યારે સમજી લેવાનું કે, તમારી પાસે કંઇક તો આશા છે જ. ચાણક અને ચતુર માણસ કેટલીકવાર તમારા માઇનસ પોઇન્ટ ને તમારા પ્લાસ પોઇન્ટસમાં ખપાવવાનો પ્રયાસ કરી ખોટી પ્રશંસા કરવા લાગે છે. ત્યારે સમજી લેવાનું કે, તેમાં તેમનો નર્યો સ્વાર્થ જ ભરેલો હોય, જે શિયાળે કાગડાની બિલકુલ ખોટી પ્રશંસા કરી ચાલાકીથી પૂરી પડાવી લીધી.

પ્રશંસામાં હંમેશા તમારા પ્લાસ પોઇન્ટ દોહરાવવામાં આવે છે, માયનસ પોઇન્ટ નહિ...

પ્રશંસામાં રહેલા અસત્યને જાણવું સમજવું કે ગંભીરતાથી વિચારવું પણ જોઇએ...

પ્રશંસા તો ભગવાનને પણ વહાલી લાગે છે, માણસ પામર વ્યક્તિ છે કેમ વહાલી ન લાગે

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n24/mode/1up

realpatidar.com

પ્રશંસામાં સત્યે કેટલું છે? તે તમારી જાતને પૂછજો ઉત્તર ખુદને મળી જશે...

કેટલાક લોકો પ્રશંસામાં ફુલાઇ જઇ ખોટા કાર્યમાં સહકાર આપતા હોય છે!

ટીકામાં બચાવની વૃત્તિ છોડી સત્ય કેટલું છે તે ગંભીરતાથી વિચારવું જોઇએ!

કેટલાક લોકો પોતાની ખોટી પ્રશંસામાં રહેલા અસત્યને નજર અંદાજ કરી ફૂલાઇ જાય છે ને સામી વ્યક્તિના સ્વાર્થ કામનો સ્વીકાર કરી તેના ઉપર મહેરબાન બનતા હોય છે!! પ્રશંસામાં રહેલા અસત્યને જાણવું સમજવું અને ગંભીરતાથી વિચારવું પણ જોઇએ. કારણ કે તમારી થઇ રહેલી પ્રશંસામાં સત્ય કેટલું છે? આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછશો તો તેનો ઉત્તર તમને ખુદને મળી જશે. તમને વધારે પડતું તેમજ જુઠું બોલવાની ટેવ હોય, તમે જાણો છો કે ઘણા અવગુણો મારામાં રહેલા છે. એ અવગુણોને ગુણોમાં તબદીલ કરી તમોને 'સાચાબોલા', 'ભોળા' જેવા વાક્યોથી પ્રયોજવામાં આવે ત્યારે તમારે તમારી અંદર રીચર્સ કરવું કે આવા શબ્દોને લાયકં હું છું ખરો?

માની લો કે તમારા થોડા બહુ વખાણ કર્યા અને તમે ખુશ થઇ તેમનું કાર્ય કરી આપો... પરંત એનું એ કાર્ય પાર પાડવા તમારે કોઇ મુશ્કેલીનો સામનો કરવાનું જોખમ તો રહેતું નથી ને? એટલું જ નહિ એ કાર્ય પાર પાડવા નૈતિક મૂલ્યોનું તો પાલન થઇ રહ્યું છે ને? એ પણ વિચારવું જોઇએ.

'કેટલાક માણસો પોતાની પ્રશંસા સાંભળીને સામેની વ્યક્તિનું ઇચ્છીત, સાચું-ખોટું જાણ્યા વગર ખોટા કાર્યમાં પણ સહકાર આપતા હોય છે' ભલે પછી પોતાને કંઇ નુકશાની વહોરવી પડતી ન હોય, પરંતુ તેમાં નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન થતું હોય છે.

તમારી થઇ રહેલી પ્રશંસામાં અસત્ય કેટલું છે? તે અજાણવાનો કે સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે તમને કોઇ મુર્ખ તો બનાવતું નથી ને? જેમ શિયાળે કાગડાને મુર્ખ બનાવી ખોટી પ્રશંસા કરી તેની પાસેથી પૂરી પડાવી લીધી. તેમ આપણે કાંઇ ગુમાવવું ભલે આર્થિક ન હોય! અન્ય કોઇ બાબતમાં જેમ કે તમારી પ્રતિષ્ઠામાં પણ આંચ આવી શકે. એવા કાર્યમાં આગળ વધું ન જોઇએ.

પ્રશંસા તો સૌ કોઇને વ્હાલી લાગે છે. કહેવત છે કે પ્રશંસા તો ભગવાનને પણ ગમે છે, તો માણસ તો પામર વ્યક્તિ છે. એને કેમ વ્હાલી ન લાગે. પોતાના થોડા બહુ વખાણ સાંભળી સામેની વ્યક્તિનું શક્ય યથાયોગ્ય કાર્ય તમારાથી થઇ શકતું હોય તો જરૂર કરો. પરંતુ ઉલ્લુ બનાવીને તમારી પાસેથી કોઇ એવું કાર્ય તો કરાવતો નથી ને જેના કારણે તમારે કંઇકને કંઇક ગુમાવવું-મતલબ મુશ્કેલીમાં આવી જવું પડે અથવા તો મૂકાવવું પડે.

દા.ત. આજકાલ ઇમોશનલ અફેરમાં સામેનું પાત્ર તમારા પ્લસ પોઇન્ટની જ વાત દોહરાવશે. મતલબ તમારા માઇનસ પોઇન્ટની કદી ચર્ચા જ નહિ કરે એટલે તમને એ વ્યક્તિ સારી લાગશે. તમે ત્યારે એવું પણ વિચારવા લાગશો કે, આ પાત્ર મને સમજી શકે છે અને તમે તીવ્ર લાગણી ધરાવી સામેના પાત્રને સમર્પિત થઇ જવાની લાગણી ધરાવશો.

હવે ટીકા વિષયક ચર્ચા કરીએ તો... તમારી ટીકા કરનાર વ્યક્તિ પ્રત્યે તમને નફરત કે અણગમો પણ થઇ આવે... એ સ્વાભાવિક છે. પરંતુ તમારી થઇ રહેલી ટીકામાં સાથે સાથે એ પણ વિચારવું જોઇએ કે, તેમાં તથ્ય શું છે? ગંભીરતા સાથે વિચારો કે તેમાં કેટલું સત્ય છે. કેટલીક વ્યક્તિઓ પોતાની થઇ રહેલી ટીકાના સંદર્ભમાં બચાવ કરવાની વૃત્તિ ધરાવતા હોય છે! તમે ખોટા બચાવ કરશો તો તમારી ભૂલ સુધારવાનો તમારો પ્રયાસ જ નહિં રહે. હંમેશા સત્ય સ્વીકારવું જોઇએ. સત્ય સ્વીકારવાથી ફાયદો એ થશે કે, તમે બીજીવાર ભૂલ નહિ કરો! પણ જો બચાવ જ કરતા રહેશો તો તમે ત્યાંને ત્યાં જ ઉભા રહી જશો. ન તો તમારામાં ફેરફાર થઇ શકશે કે નહિં સુધારો...

ટીકા સાચી પણ હોઇ શકે છે અને ખોટી પણ... પરંતુ સાચી થઇ રહેલી ટીકામાનું સત્ય સ્વીકારવાનું મન બનાવશો અને બચાવ કરવાનો પ્રયાસ નહીં કરો તો સરવાળે લાભપ્રદ તમને જ રહેશે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે તે એ છે કે, તમારી કોઇ ભૂલ કે તમે જે કંઇ કાર્ય રી રહ્યા છો તેમાં તમે ખોટા છો!!! છતાં તમો તમારું અસત્ય સત્યમાં

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n25/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

તમારી થઇ રહેલી પ્રશંસામાં સત્ય કેટલું છે તે તમે તમારી જાતને પૂછશો તો... ઉત્તર ખુદને મળી જશે ટીકાખોર સારો પણ પ્રશંસાખોરથી હંમેશા ચેતેની ચાલવું!

ખપાવવાની કોશિષ કરો ત્યારે તમને મોંઢા મોઢ, તમારી સમક્ષ તમારી ટીકા કરવામાં આવે ત્યારે... ટીકાખોર પ્રત્યે ક્યારેક ઉગ્ર થશો નહિં ને સામેની વ્યક્તિની ટીકાનું સંશોધન કરશો. તમારી ક્ષતિ ભૂલ બાબતે સન્મુખ કહેવામાં આવે તે ટીકા અને પાછળ કહેવામાં આવે તે નિંદા. ટીકાખોર સારો પણ નિંદાખોર કે પ્રશંસાખોરથી ચેતીને ચાલવું એ જીવનના હિતમાં છે!!

બાબત કોઇપણ હોય! ટીકા કરનાર અને થઇ રહેલી ટીકાઓ સત્ય હોય તો તેને સ્વીકારવું જોઇએ. દા.ત. વિરોધપક્ષવાળા શાસક પત્રની ટીકા કરતા હોય એ સાચું... પરંતુ તેમાંના સત્યને સ્વીકારવું જોઇએ. કદાચ શાસક પક્ષવાળા એમ જ વિચારે અને કહેતા ફરે કે, વિરોધ પત્રનું કાર્ય જ ટીકા કરવાનું છે તો શાસક પક્ષવાળાઓથી પબ્લિકનું ભલું ન થઇ શકે! એવી જ રીતે કોઇ વ્યક્તિ પરિવાર, સમાજ કે પછી કોઇ વર્ગ વગેરેમાં જે બાબતમાં લઇને ટીકા થતી હોય તો તેમાંના સત્યને નજર અંદાજ કરવાનો પ્રયાસ ન કરવો જોઇએ. ટીકામાં હંમેશા 'અસત્ય, વિરોધ, નારાજગી' કે પછી નફરત કરવાની વૃત્તિ છોડવી જોઇએ.

ટીકામાંના સત્યને સમજી સ્વીકારવું ડહાપણ ભરેલું ગણાય. બીજા અર્થમાં કહીએ તો તમારા દ્વારા થઇ રહેલા ગલત કાર્યમાં તમે આગળ વધતા અટકી જશો. ટીકા હંમેશા વિરોધભાવથી કરવામાં આવી રહી છે ને તથ્ય વગરની છે, એવી દલીલ કે બચાવ કરવાને બદલે તેમાંના સત્યને સમજી સ્વીકારવું જોઇએ. ને ટીકા હંમેશા ગલત ઇરાદાથી કરવામાં આવી છે તેવો પૂર્વગ્રહ છોડવો જોઇએ.

UMIYA IND ®

Shree
Umiya Industries



B/26, Sakriben Estate, Nr. Revabhai Estate, C.T.M. Char Rasta, Amraiwadi, Ahmedabad - 380 026 INDIA.
Telefax : +91 79 25854951 • Mo. 98250 51068 (Bharat Patel) (Harsadbhai Patel)
E-mail : shreeumiyaind@yahoo.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n26/mode/1up

realpatidar.com

કચ્છમાં જાડેજા વંશને સ્થાપના...

(ગતાંકનું ચાલુ)

મુસલમાન ધર્મના પ્રચારથી પણ પહેલાં તેમની કુળદેવી આશાપુરા દેવીનું પૂજન અને ભક્તિ કરવાની સમા વંશની રીત હતી. તે પણ તેઓ સહજ અને સહેલાઇથી કરતા. તેઓ હિન્દુ ધર્મના સાધુસંતોનો અને મુસલમાન ઓલિયાઓનો સમાન ભાવથી આદર કરતા, કારણ કચ્છ બન્ને ધર્મના પ્રખર સંત પુરુષોની તપોભૂમિ રહેલ છે. આના પરિણામે કચ્છ રણ પારના પ્રદેશનોના રાજકારણમાં તદ્દન ઓછો ભાગ.લેતું. હિન્દુ અને મુસલમાન બન્નેને રક્ષણ આપતું. કોઇ આક્રમણ કરનારને લૂંટ કે ખજાના માટે આકર્ષણ કરે તેવું સ્થળ ન હતું. વધારામાં તદ્દન સ્વતંત્ર મુલક તરીકે વર્તાવ કરી નજીકના રાજવીઓનું માનભંગ થાય તેવી હરીફાઇથી તે દૂર રહેતું, તેથી તે ઘણે અંશે અલગ જ રહેવા પામ્યું. પરંતુ મુખ્ય ભૂમિ સાથેન વ્યવહાર તદ્દન બંધ પડી ગયો હોય એમ ન હતું. ૧૪મી સદીના આરંભમાં જ્યારે અલાઉદ્દીન ખીલજીના લશ્કરે સિંધમાંથી સમાઓનો પરાજય કરી, તેમની રાજધાની તૂર શહેરનો નાશ કર્યો ત્યારે સિંધમાં વણસેલી પરિસ્થિતિથી બચવા ફરીથી સમાઓ અને સંભવ છે કે સૂમરા કુટુંબો પણ સિંધ છોડી કચ્છ આવવા લાગ્યાં. બારાના જાગીરદાર ગજણના પ્રપૌત્ર અબડા વિશે એક કચ્છી દંતકથા ચાલે છે કે, સૂમરા રાજવંશની કેટલીક સૂમરીઓ સિંધથી નાસી, કચ્છ તરફ જતી હતી, તેથી પૂંઠે પડેલા અલાઉદ્દીન ખીલજીના લશ્કરની એક ટુકડીને અબડાએ શિકસ્ત આપી હતી અને સૂમરીઓને બચાવી લીધી હતી.

સુલતાનના મૃત્યુ બાદ તુરત જ સિંધ અને ગુજરાતના સૂબાઓએ દિલ્હીની સત્તા સામે બંડ કર્યાં અને મહમદ બિન તઘલખ દિલ્હીની ગાદીએ આવ્યો ત્યાં સુધી આ બન્ને પ્રદેશો ઉપર દિલ્હીનું વર્ચસ્વ પાછું આવ્યું ન હતું. લોઅર સિંધમાંથી જે સમાઓ કચ્છ તરફ પ્રયાસ કરી ગયા ન હતા તેઓએ હવે સૂમરાના જુલમમાંથી મુક્તિ મળી, એટલે તેમણે પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું અને ઠઠ્ઠામાં રાજધાની બનાવી, તેમના મોવડીએ જામનું પુરાણું ઉપનામ ધારણ રાજ્ય સ્થાપ્યું અને ઠઠ્ઠામાં રાજધાની બનાવી., તેમના મોવડીએ જામનું પુરાણું ઉપનામ ધારણ કર્યું. સમાની જે શાખા આ પ્રમાણે સિંધમાં સ્થિર થઇ, તેણે કચ્છ તરફ દેશાંતર કરી ત્યાં જ સત્તારૂઢ થયેલા સમાઓ કરતાં મુસલમાન ધર્મનો વધારે ચુસ્તપણે અંગીકાર કર્યો જણાય છે, પરંતુ આ બન્ને શાખાઓએ પોતાના વંશ પરંપરાગતની ધાર્મિક સહિષ્ણુતા એકસરખી રીતે જાળવી રાખી હતી એમ જણાય છે. કચ્છી અને સિંધી સમાઓ વચ્ચે 'જેહાદો' થઇ ન હોતી. તેવી જ રીતે કચ્છની ભૂમિ ઉપર પણ ધર્મના ઓઠા હેઠળ ધાર્મિક યુદ્ધો પણ થયાં ન હતાં. મલિક તાગીની પૂંઠે સિંધ ઉપર જયારે મહમદ તઘલખ ઇ.સ. ૧૩૫૧માં ચડી આવ્યો ત્યારે સમાઓથી સિંધમાં રહી શકાશે નહિ, એમ તેમને ખાતરી થઇ અને તેઓએ કચ્છમાં સારું આશ્રય સ્થાન મળ્યું. મજદૂર મલિક તાગીએ ગુજરાતમાંથી શાહી સત્તાને ઉથલાવી નાખી હતી, પણ તે પાછળથી હાર પામ્યો અને તેણે સિંધમાં આશ્રય લીધો.

સુલતાન મહમદ ઠઠ્ઠા તરફ કૂચ કરતાં રસ્તામાં જ મૃત્યુ પામ્યો અને શાહી લશ્કરને સમાઓએ સારી રીતે ટૂંકું કરી નાખ્યું, જેથી તત્કાળ પૂરતો ભય સિંધ પરથી પસાર થઇ ગયો.

તે પછી સુલતાન ફિરોઝશાહ તઘલખે મહમદના લશ્કરની હાર બદલ વેર લેવા નિશ્ચય કર્યો અને ઘોડેસવાર તથા હાથીઓવાળા એક પ્રચંડ લશ્કર સહિત ઠઠ્ઠા તરફ તે કૂચ કરી ગયો. સિંધુ નદીના ત્રિકોણ પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીઓ સહેલાઇથી થઇ શકે તે માટે તેણે પોતાની સાથે હોડીઓ પણ રાખી હતી, પરંતુ સિંધી અને કચ્છી નાવિકોની બરાબરી કરી શકે તેવા તેની પાસે ખલાસીઓ નહોતા. ઠઠ્ઠાના જામે પોતાનો બચાવ એટલો તો બહાદુરીથી કર્યો, કે સુલતાને જીતની

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n27/mode/1up

realpatidar.com

આશા છોડી દીધી અને ગુજરાત (જે ફરીથી પૂર્ણ શાહી વર્ચસ્વ નીચે આવી ગયું હતું.) પાછા ફરી, વધારે બળવાન લશ્કર સજ્જ કરવા તેણે નિશ્ચય કર્યો, પાછા ફરતી વખતે કચ્છના સમાઓ કે જેમણે પોતાના સિંધના ભાયાતોને સુલતાનને હઠાવવામાં મદદ કરી હતી, તેને બદલો દેવાની સુલમાનની ઇચ્છા થઇ. પરંતુ રણના કાદવ-કીચડમાંથી પસાર થવામાં તેના લશ્કરને ભયંકર વિપત્તિઓમાંથી પસાર થવું પડ્યું હતું. આથી તેમાંના અસંખ્ય માણસો માર્યા ગયા અને ફક્ત નામનું લશ્કર જ પેલે પાર ઉતરવા પામ્યું. સુલતાન પોતે તો તદ્દન માર્ગ ભૂલી ગયો અને ઘણા દિવસો સુધી તેના કશા સમાચાર મળ્યા નહિ. કચ્છના રણ મારફણ પસાર થતા તેના લશ્કરનો આવી રીતે નાશ થયો હતો, તેની આવી નોંધ પહેલી જ હતી. ત્યાર બાદ પણ આ જ પ્રકારના અનુભવ રણ ઓળંગતા થયા.

કચ્છ પર આક્રમણ કરનારને રણને લીધે જે અનહદ મુશ્કેલીઓ અને જોખમો વેઠવાં પડે છે, (ખાસ કરીને ગુજરાત અને સિંધને લગતી સરહદો વચ્ચે) તેને લીધે કચ્છ એક દૂરદૂરનો પ્રદેશ છે, એવી કચ્છની નામના વધારે દઢ થતી ગઇ.

સુલતાન ઇ.સ. ૧૩૬૩ની આસપાસ વધારે સહીસલામત રસ્તે પાછો ફર્યો અને ઠઠ્ઠાના જામને દિલ્હીની શરણાગતી સ્વીકારવા ફરજ પાડી. થોડા સમય બાદ જ જામે દિલ્હી સલતનતને ખંડણી ભરવાની શરત સ્વીકારી અને તેને પાછો પોતાના રાજ્યનો કારભાર સોંપવામાં આવ્યો. સમા વંશનું રાજય લોઅર સિંધમાં ૧૬મી સદી સુધી એકધારું ચાલુ રહ્યું. તેમના કચ્છી સમારો સાથેના સંબંધો સારા રહ્યા હતા અને પહેલા મોગલ શહેનશાહ બાબર (મરણ ઇ.સ. ૧૫૩૦)ના સમયમાં ઠઠ્ઠાનું રાજ્ય આરગણ રાજાઓએ કબજે કરી લીધું ત્યાં જામવંશનો છેલ્લો રાજા જામ ફિરોઝ નાસીને કચ્છમાં આશ્રય માટે આવ્યો હતો.

સૌરાષ્ટ્રની બાજુએથી કચ્છ આવવું-જવું વધારે સહેલું હતું. ફિરોઝશાહ તઘલખના વંશના બાદશાહોમાં પ્રમાણ અને મોજશોખને લઇને સડો દાખલ થતો જવાથી દિલ્હીની શહેનશાહત નબળી પડતી ગઇ અને ગુજરાતના સૂબા ઝફરખાને ઇ.સ. ૧૩૯૬માં 'મુઝફ્ફરશાહ' નામ ધારણ કરી પોતાને સ્વતંત્ર બાદશાહ તરીકે જાહેર કર્યો અને અણહિલવાડના જૂના રાજય પર પોતાની સત્તા જમાવવાનું શરૂ કર્યું. ઇ.સ. ૧૪૧૦માં વાગડ પર સત્તા જમાવવા નિશ્ચય કર્યો અને કંથકોટના કિલ્લાનો રાજવી જે હજી સુધી દેદાના વંશનો જ હતો તેને તાબે થવા ફરજ પાડી. પણ કચ્છના બીજા વિસ્તારોને તેણે તાબે કર્યા હોય તેવું કંઇ જણાતું નથી. એટલું ખરું કે કચ્છ અન અણહિલ પાટણનો જૂનો સંબંધ તેણે ફરી ચાલુ કર્યો અને આ સંબંધ, તેના (મુઝફ્ફરશાહના) પૌત્ર અને અનુગામી વારસ બાદશાહ અહમદશાહે અણહિલ પાટણના જૂના પાટનગરને તજી દઇ અમદાવાદ નામનું નવું શહેર (જે હજી ગુજરાતનું રાજધાનીનું શહેર છે) વસાવ્યું, ત્યાં સુધી ચાલુ રહ્યો.

આ વંશનો સૌથી મોટો બાદશાહ સુલતાન મહમદ બેગડો થયો. (ઇ.સ. ૧૪૫૮-૧૫૧૧) આ ઉપનામ તેને બે મોટા પ્રખ્યાત ડુંગરી કિલ્લા ગિરનાર અને ચાંપાનેર જીતી લેવાને કારણે મળ્યું. તેણે વિચાર્યું કે ગુજરાતની સત્તા જ્યાં નામની જ ચાલતી હતી, તેવા કચ્છ પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપવાનો હવે અનુકૂળ સમય આવ્યો. કાઠિયાવાડ તેના તાબામાં હતું. ત્યાંના વ્યાપારીઓને તે ઘણો આશ્રમય આપતો હતો અને તુરત તે સમજી ગયો કે તેના રાજ્યની આબાદીનો આધાર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના પ્રદેશમાં તેમજ આસપાસના સમુદ્ર પર કાયદો અને સુવ્યવસ્થા જળવાય તેમના ઉપર જ છે. આ ઉદ્દેશથી તેણે એક બળવાર દરિયાઇ કાફલો વ્યવસ્થિત રીતે ઊભો કર્યો અને તેની સત્તાથી દ્વારકા અને કચ્છના ચાંચિયા લોકોની દરિયાઇ લૂંટફાટ દાબી લીધી. કચ્છ પરનાં આવી જાતનાં આક્રમણો કચ્છના ચાંચિયા લોકોને, આસપાસના દરિયામાં હરાવી, નસાડી મૂકવાના ઇરાદાથી કરવામાં આવ્યાં હતાં કે તે ઇસ્લામ ધર્મ ફેલાવનાર અને ધર્માંતર કરાવવામાં નિષ્ણાત હતો તેથી કચ્છમાં મુસલમાન ધર્મના પ્રસાર માટે પૂરતી અનુકૂળતા કે છે નહિ, તે જાણવા માટે કરવામાં આવ્યાં હતાં, તે ચોક્કસ નથી. એટલું તો ચોક્કસ છે કે,

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n28/mode/1up

realpatidar.com

ઇ.સ. ૧૪૭૨માં ઉચ્ચ પ્રકારની તાલીમ પામેલા ૩૦૦ ઘોડેસવારના લશ્કરથી તે વાગડમાં ઊતર્યો અને ત્યાંના ભાયાતી લશ્કરોએ ખાસ કરીને તીરકામઠાંથી તેનો સામનો કર્યો અને તેને હરાવ્યો. આટલા ઘોડેસવારોની નાની ફોજથી લડાઇ કરીને તે આખા કચ્છનો કબજો મેળવી શકે તેમ તો નહોતું. આ સમય સુધીમાં લગભગ દરેક ટેકરી ઉપર ગઢ બાંધી, કોઇને કોઇ નાના-મોટા ગરાસિયા ત્યાં રહેતા હતા. દરેક ગામને ફરતો ગઢ બંધાયેલો હતો અને ત્યાંના રહેવાસીઓ તેનું બરાબર રક્ષણ કરવાને હંમેશા તૈયાર હતા. વધારે સંભવિત છે કે મહમદ બેગડો એક પ્રભાવશાળી અને મહાન બાદશાહ તરીકે ગણાતો.

સઘળા જાડેજા સરદારોને તેમની જાગીરોનું ઘણીપણું કાયમ કરી આપવા તે તૈયાર હતો અને તેમના વંશમાં જે નબીરાઓ લશ્કરી તાલી લેવાને તૈયાર હોય તેમને હિંદના પશ્ચિમના રાજ્યમાં મોકલાવતો કે જેથી તેઓની લડાયક બહાદુરીને કારણે તેઓ પોતાની કારકિર્દી સંપૂર્ણ રીતે ઉજ્જવળ બનાવી શકે. ખરેખર જોતાં તો બહારની દુનિયાના પ્રતિનિધિ તરીકે અને ચુસ્ત ઇસ્લામ ધર્મના સ્તંભ તરીકે, ધર્માન્તર કરવા માગતા હોય તેમને અપનાવવા અને કચ્છના મુસલમાનો જેમણે જૂનો મુસલમાન કારમેથીયત સંપ્રદાય સ્વીકાર્યો હતો તેમને સાચી તાલીમ આપવા તે કચ્છમાં આવ્યો હતો. મહાન જાડેજા વંશ તરફ તનો વર્તાવ સહિષ્ણુવાળો હતો. લાખિયાર વીરના હમીરજી જે જામ ઓઠાથી આઠમી પેઢીએ હતા, તેની દીકરી કમાંબાઇને પરણીને તે અમદાવાદના પોતાના જમાનામાં રાખવા સાથે લઇ ગયો અને તેણીની સાથે તેના સગા ભાઇ અલિયાજીએ પણ અમદાવાદ લઇ ગયા.

સુલમાન બેગડાએ ગજણના વંશજો જે ઓઠાના વંશજોના હરીફ હતા તેમના તરફ પણ પોતાની કૃપાદષ્ટિ બતાવીને નવાજેશો કરી હતી. ગજણજીના વંશમાં આઠમો જાડેજો લાખો કે જે પ્રખ્યાત યોદ્ધો હતો, તેની શુરવીરતા અને આયુધો વાપરવાની નિપુણતા તરફ પણ બાદશાહનું ધ્યાન ખેંચાયું અને લાખાને સુલતાન મહમદ બેગડાએ કાઠિયાવાડમાં આમરણ અને ગોંડલની જાગીરો જે તેના પોતાના કબજામાં હતી તે તેને આગળ વધારવાના ઇરાદાથી ભેટ આપી. આ જાગીરનો કબજો મૂળ તો એવા ઠાકોરોનો હતો કે જે સુલતાનની સત્તાનો સામનો કરતા હતા. લાખાને તેની ભેટ આપવાથી સુલતાનના બે ઉદ્દેશો બર આવતા હતા. પ્રથમ એ કે એક જાડેજા રાજવી પર ઉપકાર થત હતો અને બીજો એ કે પોતાના દુશ્મનો સામે એક બળવાન સામનો કરનાર ઊભો કરી શકાતો હતો. પણ કમભાગ્યે બેગડાની આ નવાજેશથી તો કચ્છના ઇતિહાસમાં કલંકરૂપ બનેલા એવા કુટુંબ-કલેશનાં બીજો રોપાયાં.

ખૂંખાર લડાઇ કરી લાખાએ પોતાની નવી જાગીરનો કબજો મેળવ્યો અને જાડેજા વંશના, બારા જાગીરના આદિ પુરુષ ગજણ પછીના જાડેજા રાજવી હાલાજી, જે તેના વડીલ થયા તે હાલાના નામ પરથી તેનું નામ હાલાર તરીકે જાહેર કરી, તયાં એક મોટું જાડેજા રાજ્ય કાઠિયાવાડમાં સ્થાપ્યું.

પરંતુ આ જાગીરોના મૂળ માલિકોને હાંકી કાઢવામાં કે તેમનો સદંતર નાશ કરવામાં તેમનાં કુટુંબો સાથે [illegible] અનેક વેરઝેર ઊભાં કર્યું. આમાંના એક ઝગડાનું પાછળથી બહુ જ ભયંકર પરિણામ આવ્યું. એમ કહેવાય છે કે ૧૬ની સદીની શરૂઆતમાં લાખાએ પોતાના વડીલોની જાગીરમાં ફરી આવવાનો વિચાર કર્યો અને બારા જતાં રસ્તામાં લાખિયાર વીરા જાગીરની હકૂમતમાંથી તે પસાર થયો. તે જાગીર સામેના ખરાબ સંબંધોને કારણે તેમને ત્યાં મહેમાન થવા તે ખુશી નહોતો અને તેથી હબાય ડુંગરથી થોડે દૂર આવેલ એક સંગારના તાબાની વાઢમાં તે ઊતર્યો. જ્યારે લાખો અહીં વિશ્રામ લઇ રહ્યો હતો ત્યાં કેટલાક ઝનૂની માણસોએ તેને મારી નાખ્યો.

આ માણસોના કુટુંબોઉપર લાખાએ જે કેર વર્તાવ્યો તેનું વેર લેવા માટે તેઓ હાલારથી જ લાખાની પૂંઠે પડ્યા હતા. લાખાનો દીકરો રાવળ જે પાછળથી બહુ મશહુર થયો, તેણે પોતાના પિતાના ખૂન માટે લાખિયાર વીરાના ઓઠા વંશના હમીરજીને જવાબદાર ગણયા અને ઇ.સ. ૧૪૭૨માં ભીમજી પછી હમીરજી ગાદીએ આવ્યા, તેના ઉપર પોતાનું વેર લેવા સોગંદ લીધા. (ક્રમશઃ)

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n29/mode/1up

realpatidar.com

શ્રી ઉમિયા દ્વારેથી...

સંપાદન અને આલેખન : શ્રી પ્રહલાદભાઇ એલ. પટેલ, શ્ર ઇશ્વરભાઇ એ. પટેલ

શ્રી અડતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ-માણસા

શ્રી અડતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ, માણસાનો સુવર્ણ જયંતિ મહોત્સવ તા. ૨૮/૧૨/૧૩ અને ૨૯/૧૨/૧૩ એમ બે દિવસ ભવ્ય રીતે ભક્તિભાવ પૂર્ણ સામાજિક, શૈક્ષણિક, રચનાત્મક દષ્ટિકોણથી સમાજને સમર્પિત ભાવ સાથે ભારે મોટા દાનવીર શ્રેષ્ઠીઓના ઉત્સાહથી ઉજવાયો. આ સમાજ સંગઠનને ૫૦ વર્ષ થયાં. માઁ ઉમિયાના આશિર્વાદથી કેટલાયે ભડવીરો અને ભામાશાઓની અમૂલ્ય ભેટ આ સમાજે ધરી છે. અન્ય સમાજ માટે પ્રેરપા સ્રોત બની રહ્યો છે. ઉમિયા કેમ્પસ સમાજના સૌ સભ્યોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરનાર મહાતીર્થ છે.

ઉમિયા તીર્થ, માણસા વિશાળ વનરાજી, લીલોતરી સભર, કલાકૃત, રહેવા જમવાની અદ્યતન સુવિધા પૂર્ણ પ્રવાસ પર્યટન ધામ તરીકે વિખ્યાત છે. માઁ ઉમિયા સહુને આશિર્વાદ સહ નિમંત્રે છે. આ મહોત્સવમાં લાખોના દાન આપનાર તમામ દાતાશ્રીઓ, ભામાશાઓ સહુ કાર્યકરો, બહેનો શ્રેષ્ઠીઓ સહુને ખૂબ ખૂબ અભિનંદન...

મહોત્સવને સફળતા અપાવવામાં પ્રમુખ શ્રી ડી.ડી. પટેલ, મહામંત્રીશ્રી સાંકળચંદભાઇ, કન્વીનરશ્રી વિઠ્ઠલભાઇ, ગોવિંદભાઇ, ગોરધનભાઇ તમામ દાતાઓ, આગેવાનો, કાર્યકરોને માઁ ઉમિયા સુખી, સમૃદ્ધિ, આબાદ રાખે તેવી શુભેચ્છા સહમંત્રીશ્રી ઇશ્વરભાઇ. શિક્ષણ સમિતિ મંત્રીશ્રી પ્રહ્લાદભાઇ જે. પટેલે તેમજ ઊંઝાની ટીમ મહોત્સવથી ખૂબ જ પ્રભાવિત દાતાશ્રીઓ અને સહુ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન.

સરદારધામ ભૂમિ પૂજન સમારોહ

વિશ્વ પાટીદાર કેન્દ્ર સંચાલિત સરદારધામ ભૂમિપૂજન સમારોહ તા. ૧૨/૦૧/૧૪ રવિવારે બપોરે ૩-૦૦ કલાકે વૈષ્ણોદેવી સર્કલ, એસ.પી. રીંગ રોડ, અમદાવાદ ખાતે ભારે ઉત્સાહ ઉમંગથી ભારે ઠાઠમાઠથી ઉજવાયો. ગામથી લઇ વિશ્વ પાટીદાર સમાજની આર્થિક, સામાજિક, આરોગ્ય, કેરિયર ડેવલોપમેન્ટ સર્વાંગી વિકાસ કેન્દ્ર બનાવવાની નેમ સાથે ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રૂા. ૧૦૦ કરોડની વિવિધ જાહેરાતો સાથે દાતાઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. પ્રથમ ચરણમાં હોસ્ટેલ નિર્માણ કરવાનું આયોજન છે. ત્યારબાદ ધંધાકીય માર્ગદર્શન રોજી રોટીની સમસ્યા હળ કરવી. ગામડેથી આરોગ્ય સુવિધ ામાટે આવતાઓની રહેવાની, જમવાની, સુવિધાપૂર્ણ ગેસ્ટ હાઉસ બનાવવું, શૈક્ષણિક લોન તેજસ્વી વિદ્યાર્થીઓને મળી રહે, દીકરા દીકરીઓને સન્માનપૂર્વક રોજગારી મળી રહે તેવા પાટીદાર સમાજના સર્વાંગી વિકાસને સાંકળતી પ્રવૃત્તિઓના આયોજન સાથેના સરદાર ધામ નિર્માણના નેજા નીચે આપણે સૌ એક થઇ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવા સરદારધામની છત્રછાયામાં સંગઠીત થઇએ. આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાન વિકાસ, ઉદારીકરણ, વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન કરી સમાજનો સુચારું વિકાસ કરવાનું આયોજન છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n30/mode/1up

realpatidar.com

આ વિચારમાં સમસ્ત પાટીદાર સુરત, ઉમિયા માતાજી મંદિર, ઊંઝા, ઉમિયા માતાજી સિદસર, કાગવડ મંદિર-અડાલજ વગેરેનું ભારે યોગદાન સહકાર રહેશે. આ સરદાર ધામ ભવિષ્યમાં સરદારની પ્રેરણા મુજબ બધી સમસ્યાઓનું નિરાકરણ કરી સમાજની સર્વાંતીમુખી પ્રગતિનું સોપાન બની રહે તેવી આશા જરૂરી રાખી શકાય.

ગુજરાતના ગોળ સમાજના હોદ્દેદારશ્રીઓ-શ્રેષ્ઠીઓ-દાતાશ્રીઓની મિટીંગ-ઊંઝા

ઉત્તર ગુજરાતના ગોળ સમાજના આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ, શ્રેષ્ઠીઓની એક મિટીંગ ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના સત્સંગ હોલમાં સંસ્થાના પ્રમુખશ્રી અનિલભાઇના પ્રમુખ પદે મળી. જેમાં સંસ્થાના સહમંત્રીશ્રી ઇશ્વરભાઇ એ. પટેલે સહુનું સ્વાગત કર્યું. મહામંત્રીશ્રી વિક્રમભાઇ પટેલે મિટીંગનો હેતુ સમજાવ્યો. પ્રહ્લાદભાઇએ હરિદ્વારમાં ઉમિયા ધામ અંગે વિગતે માહિતી આપી. સહમંત્રીશ્રી દિલીપભાઇએ હરિદ્વારમાં આજસુધીમાં થયેલ કામગીરીની માહિતી આપી.

અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શ્રી કીર્તિભાઇ શાહએ હરિદ્વારમાં સૂચિત પથિકાશ્રમ અંગે લે-આઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન પડદા ઉપર દર્શાવ્યું. મિટીંગમાં પધારેલા આમંત્રિતો કે.કે. પટેલ, તુલસીભાઇ પટેલ વગેરેએ પોતાના વિચારો વ્યક્ત કરી અને મંતવ્યો દર્શાવ્યા. સહુના દિલમાં અદ્યતન સુવિધાવાળો પથિકાશ્રમ બનાવાનું સ્વપ્ન છે. શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વાસુદેવભાઇ એ શિક્ષણ સહાયનિધિ ઉપર ભાર મૂક્યો. સંસ્થાના ઉપપ્રમુખશ્રી નારયણકાકાએ ભૂમિદાન માટે ગામડે ગામડે પહોંચી વધુ જાગૃતિ લાવવા સંગઠન-સમિતિઓ બનાવવાનું સૂચન કર્યું. પ્રમુખ સ્થાનેથીશ્રી અનિલભાઇએ પાટીદાર સમાજને શોભે તેવું અદ્યતન પથિકાશ્રમ અને સંકુલ બનાવીએ. સમાજનું સશક્તિકારણ કરી સુંદર એસ્ટેટનું સર્જન કરીએ. સહુના ભગીરથ પ્રયત્નોથી માતા ઉમિયાના આશિર્વાદથી કામ પૂર્ણ કરવા અપિલ કરી.

બૃહદ અમદાવાદ કડવા પાટીદાર ફેડરેશન

અમદાવાદ શહેરમાં વસતા વિવિધ ગોળ સમાજ, શૈક્ષણિક ધાર્મિક સંગઠનો, સંસ્થાઓ વોર્ડવારના કડવા પાટીદાર આગેવાનોની એક મીટીંગ તા. ૧૦/૦૧/૧૪ના રોજ ઉમિયા કેમ્પસ, સોલા ખાતે ઊંઝા ઉમિયા માતાજીના મહામંત્રીશ્રી વિક્રમભાઇ પટેલના પ્રમુખપદે મળી. જેમા શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, ધંધાકીય, પ્રગતિ બાબતે વિચાર વિમર્શ થયો. સંગઠનની એક તાકાત ઉભી કરવાનું વિચાર્યું. યુવા વર્ગની રોજગારી તકો ઉપર ભાર મૂક્યો. ઉમિયા માતા ઊંઝાના પ્રમુખશ્રી અનિલભાઇ પટેલે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધવા બાબતે મનનીય સૂચનો કર્યા.

(પાન-૨૧નું ચાલુ)

કચ્છમાં કણબીનો વિસ્તાર...

જોકે, તેમણે મુસલમાનને ગુરુ કર્યા હતા તો પણ તેમની સઘળા પ્રકારની રીતભાત હિંદુની જ હતી. તેઓ માત્ર વાર્ષિક ભેટ પીરાણે મોકલતા; અન્યથા, મુસલમાનનું એક પણ વર્તન તેમનામાં નહોતું. આ પ્રમાણે કેટલાક કળા પર્યંત ચાલ્યું. તેમની વસ્તી વધતા ૧૨-૧૩ ગામોનાં પછી ૨૫-૩૦ ગામો થયાં. તેવામાં તેમણે ત્યાં એકાદ વિવાહ પ્રસંગે પીરાણા પંથનો ધર્મગુરુ પ્રાગજીકાકો, જે મહાકાબેલ હતો તે આવ્યો અને તેણે તેમને હિંદુથી નિરાળા કરી શુદ્ધ પીરના અનુયાયી બનાવા ખટપટ કરી અને વહીવંચા તથા ગોર સાથે તકરાર પડાવી, તેનો મર્મ ન સમજતાં બિચારા અંધશ્રદ્ધાળુ કબણીઓએ તે પ્રાગજીકાકાની સલાહ પ્રમાણે નખત્રાણા ગામે મળી, ગોર તથા વહીવંચાને સદાને માટે તજી દેવાનો ઠરાવ કર્યો, આ ઠરાવો હવે આવતા અંકે... (ક્રમશઃ)

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n31/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

લીમડાના પ્રબળ પ્રેમી કેન્યાના નીમ અમ્મા

જેમના વડવાઓનું મૂળ વતન સુરત હતું તેવા કેન્યાવાસી પારસીબાનું પરીન ફીટરે અપાર કડવાશમાં ગુણોની અપરંપાર મીઠાસ ધરાવતા ઔષધિય અને ગુણકારી લીમડાના મહત્ત્વને જન સાધારણ સુધી પહોંચાડવાનું અભિયાન ઉપાડયું છે. આ મહિલાનો લીમડાના બહુ ગુણકારી વૃક્ષ પ્રત્યેનો અપાર પ્રેમ જોઇને તેમને મમ્મા નીમ અથવા નીમ અમ્મા તરીકેની હુલામણી ઓળખ મળી છે. લીમડાને માધ્યમ બનાવીને પર્યાવરણ રક્ષણ સાથે જોડાયેલાં આ મહિલાને જુન ૧૯૯૨માં બ્રાઝિલમાં યોજાયેલી 'અર્થ સમીટ'માં સન્માનવામાં આવ્યાં હતાં. તે પછી તેઓએ જગતને લીમડાની ઉપયોગીતા અંગે જાગૃત કરવાનું અભિયાન ઉપાડયું છે અને આજે ૫૯ વર્ષની ઉંમરે તેને આગળ ધપાવી રહ્યાં છે. વડોદરાની મુલાકાતે આવેલાં નીમ અમ્માએ એક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે કેન્યામાં ગરીબ લોકોને મોંઘી દવાઓનો ખર્ચ પોસાતો ન હતો. તેમને લીમડાની છાલ, રસ, તેલ, લીંબોળી અને તેના મીંજનો રોગ નિવારણ માટે ઉપયોગ કરતાં શીખવાડયું અને આજે કેન્યામાં લીમડો એક કિંમતી વૃક્ષ ગણાય છે. ભારતીયો જ કેન્યામાં લીમડો લઇ ગયા હતા. કેન્યાના કૃષિ મંત્રાલયે તેમના આ નીમ અભિયાનને પીઠબળ આપ્યું હતું. નીમ અમ્મા કહે છે કે લીંબોડીને ભાંગીને તેમાંથી નીકળતી મીંજ (સીડ)ને બંને હયેળીવડે પીસીને શરીરે ઘસવામાં આવે તો તેની વાસથી મચ્છરો દૂર રહે છે. લીમડાથી ઉત્તમ કોઇ જંતુનાશક ઓષધ નથી. શારીરિક આરોગ્યની સાચવણી માટે લીમડાનો પ્રમાણસર અને સમજદારી પૂર્વક ઉપયોગ કરવાથી ખૂબ જ ઓછા ખર્ચે આરોગ્ય રક્ષા થઇ શકે છે. લીમડાની ઉપયોગીતા નવી પેઢી ઓળખે તે જરૂરી છે. ભારત લીમડાના ગુણોને ઓળખવા અને ઉજાગર કરવામાં અગ્રેસર હતું તેને ફરીથી નવચેતના

ન્યુઝ ફ્લેશ

(જી.એન.એફ.)

કરવાના નીમ અમ્માના પ્રયાસો પ્રશંસનીય છે.

કેરળમાં મહિલાઓ માટે ખાસ ટેક્સ સેવા 'શી-ટેકસી'

કેરળમાં મહિલા પ્રવાસીઓ માટેની ખાસ સેવા 'શી ટેકસી'નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. મહિલા માલિકોની આ ટેકસીઓની ડ્રાઇવર પણ મહિલાઓ હશે. રાજયમાં જાતિ સમાનતાના હેતુથી સામાજિક ન્યાય વિભાગ દ્વારા આ સેવા શરૂ કરાઇ છે. અગાઉ રચાયેલા જેન્ડર પાર્કની પહેલને આધારે જ 'શી ટેકસી' સેવાની શરૂઆત કરાઇ છે. પ્રાયોગિક ધોરણે પાંચ ટેકસી સાથે તિરુવનંતપુરમમાં આ સેવા શરૂ કરાશે. ત્યારબાદથી આગામી ત્રણ મહિના દરમિયાન તેમાં વધુ ૧૦૦ કારોને જોડવામાં આવશે. પ્રોજેકટના બીજા તબક્કામાં કોચીન અને કોઝિકોડને પણ સામેલ કરાશે. જેન્ડર પાર્કની આ યોજના માટે પ્રોજેકટ સાથે સંકળાયેલી મારુતિ સુઝુકી ખાસ ગુલાબી અને સફેદ રંગની કાર લોન્ચ કરશે. આ કારોમાં જીપીએસ, મીટર, વ્યક્તિગત અને ઇમરજન્સી ચેતવણી સર્વિસ તેમજ એન્ટરટેઇનમેન્ટ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. જેન્ડર પાર્ક યોજના માટેના લાભાર્થીઓની ઓળખ કરી તેમને રાજય મહિલા વિકાસ નિગમ પાસેથી ઓછા વ્યાજે લોન અપાવવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત મહિલા કર્મચારીઓ માટે આરોગ્ય વીમા અને આત્મરક્ષણ માટેના ખાસ પ્રશિક્ષણની વ્યવસ્થા પણ કરાશે.

બચ્ચન પરિવારની આરાધ્યા : દસ હજાર રૂપિયાના તો બૂટ પહેરે છે

દરેક માતા-પિતા તેમના સંતાનોને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતા હોય છે. પોતાના બાળકની ખુશી માટે મા-બાપ દરેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. સામાન્ય માણસની જેમ સ્ટાર્સ પણ તેમનાં બાળકોની ખુશીનું વિશેષ ધ્યાન રાખતા હોય છે તેનું જ એક ઉદાહરણ ઐશ્વર્યા છે. બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા હજુ છે તો માત્ર ૪ વર્ષની પણ થઇ નથી. પરંતુ તેની માતા

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n32/mode/1up

realpatidar.com

ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા તેની દરેક પ્રકારની ફેશનનું ધ્યાન રાખવામાં આવે છે. તમે માનશો નહીં પરંતુ અત્યારથી આરાધ્યાની ડ્રેસ ડિઝાઇનર પણ છે અને તે જ આરાધ્યા માટે ડ્રેસ ડિઝાઇન કરે છે. તે ઉપરાંત આરાધ્યા જે જૂતા પહેરે છે. તેની પણ કિંમત રૂ. ૧૦,૦૦૦ છે. બોલિવુડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા માટે ફેશન ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોલસા ડ્રેસ ડિઝાઇન કરે છે. જોકે ડિઝાઇનર દ્વારા જે પણ ડ્રેસ ડિઝાઇન કરવામાં આવે છે. તેની અંતિમ મંજૂરી તો તેની મા ઐશ્વર્યા દ્વારા જ આપવામાં આવતી હોય છે.

ઐસા ભી હોતા હૈ !

વિદર્ભ એકસપ્રેસમાં પ્રવાસ કરી રહેલા બાંદરાના ડૉકટર શીતલ કાંબળેનું ચાલુ ટ્રેને ૧૦ ગ્રામનું મંગળસૂત્ર ઝૂંટવીને નાસી રહેલા એક ચોરને લોકોએ પકડયો ત્યારે લોકોથી બચવા માટે તે મંગળસૂત્ર ગળી ગયો હતો. જોકે કલ્યાણ પોલીસે પાંચ દિવસ સુધી તેને રોજ દોઢથી બે ડઝન કેળાં ખવડાવીને એ મંગળસૂત્ર પાછું મેળવવામાં સફળતા મેળવી હતી. પહેલાં તો ૨૮ વર્ષના દામુ ગુપ્તાએ મંગળસૂત્ર ઝૂંટવ્યું હોવાનો ઇનકાર કરી દીધો હતો. પણ તે જે રીતે ઇન્કાર કરી રહ્યો હતો એ જોતાં તે રીઢો ચોર હોવાની પોલીસને શંકા ગઇ. એમાં વળી એક પેસેન્જરે જ્યારે પોલીસને કહ્યું કે તે કંઇ ગળી રહ્યો હતો ત્યારે પોલીસે પહેલાં તેનો એકસ-રે કઢાવ્યો હતો. જોકે એમાં કશું આવ્યું નહોતું. ત્યાર બાદ તેનો ડિજિટલ એકસ-રે કઢાવવામાં આવતાં તેના પેટમાં મંગળસૂત્ર હોવાનું સાબિત થયું હતું. એ પછી પોલીસે તેને રોજ દોઢથી બે ડઝન કેળાં ખવડાવ્યાં હતાં અને આખરે મંગળસૂત્ર ટોઇલેટમાં બહાર આવ્યું હતું.

વિશ્વની સૌથી મોંઘી ચા ચીનની... કિલોના રૂા. ૭.૪૦ કરોડ

વિશ્વમાં પાણી પછી જો સૌથી વધુ કંઇ પીવાતું હોય તો એ છે ચા વિશ્વમાં દરરોજ અંદાજે ત્રણ અબજ કપ ચા પીવામાં આવે છે. વ્યક્તિગત દેશની વાત કરીએ તો ચીન અને ભારતમાં સૌથી વધુ ચા પિવાય છે. પરંતુ વિશ્વની સૌથી મોંઘી ચા ચીનમાં મળે છે. ચીનની ડા-હોન્ગ પાઓ પ્રકારની વુયી ઉલોન્ગ ચાનો એક કિલોના પેકેટનો ભાવ ૧૨ લાખ ડોલર (૭.૪૦ કરોડ રૂપિયા) છે. અને વિશ્વમાં એ સૌથી મોંઘી છે. ચીનમાં સદીઓથી ઉત્પન્ન થતી આ ચાનો બહુ રસપ્રદ ઇતિહાસ છે. મૂળ તો આ ચાનો ઉપયોગ દવા તરીકે થતો હતો અને ચીનમાં ઘણા લોકો હજી પણ એને ઔષધ ગણે છે. ચીનમાં ઇ.સ. ૧૩૬૮ થી ૧૬૪૪ સુધીના સમયગાળામાં મિન્ગ વંશના રાજવીઓનું રાજ હતું અને તેમાંના એક રાજાના મમ્મી એકવાર એક રહસ્યમય ચાના ઉપયોગથી ગંભીર બીમારીઓમાંથી મુકત થયાં હતાં. રાજાએ તેમના માણસોને એ રહસ્યમય ચા કયાં ઊગે છે એ જાણી લાવવા કહ્યું અને તેઓ શોધી લાવ્યા કે એ ચા માઉન્ટ વુયી નામની પર્વતમાળાના જંગલોમાં ઊગે છે. એમાંના ત્રણ પર્વતો આજે પણ છે અને ગંભીર રોગો મટાડતી વુયી ઉલોન્ગ ચા પેદા કરે છે.

શ્રાવણ માસમાં પાનેલી ગામની ૧૨૫મી જયંતી ઉજવાશે

પાનેલી ગામના ૧૨૫ વર્ષ પૂરા થતા હોવાથી ''શપાદ્રશત મહોત્સવ'' નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં શ્રાવણ વદ-૪, તા. ૧૪-૮-૨૦૧૪ના સવારે ૮-૦૦ કલાકે રુદ્રયજ્ઞ પ્રારંભ, ૯-૦૦ કલાકે નિયાણાના સામૈયા, સાંજે ૫-૦૦ કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ, રાત્રે ૯-૦૦ કલાકે રાસ ગરબા.

શ્રાવણ વદ-૫, તા. ૧૫-૮-૨૦૧૪ના સવારે ૮-૩૦ કલાકે આમંત્રિત મહેમાનોનું સ્વાગત, ૯-૦૦ કલાકે સામાજિક સભા, બપોરે ૩-૦૦ કલાકે નિયાણાના સન્માન, રાત્રે ૯-૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ.

શ્રાવણ વદ-૬, તા. ૧૬-૮-૨૦૧૪ના સવારે ૯-૦૦ કલાકે વડીલોના સન્માન, બપોરે ૩-૦૦ કલાકે સરસ્વતી સન્માન તથા ખુલ્લો મંચ, રાત્રે ૮-૦૦ કલાકે હાલરડા અને લોક ડાયરો યોજાશે, એવું પ્રમુખ શ્રી શાંતિભાઇ હરજીભાઇ વાઘડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

– મહેન્દ્રભાઇ ચૌધરી, હાલોલ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n33/mode/1up

realpatidar.com

☺ ☺ ☺ હસે તેનું ઘર વસે.... ☺ ☺ ☺

ગોલુ : કેટલાક દિવસથી એક છોકરી મને ફોન પર પરેશાન કરે છે.

ભોલુ : કેવી રીતે ?

ગોલુ : જયારે જયારે હું કોઇને કોલ કરું છું તો તે વચમાં બોલે છે 'પ્લીઝ રિચાર્જ યોર બેલેન્સ સૂન.'

☺ ☺ ☺

પ્રિન્ટુ : મારા પપ્પા લશ્કરમાં અફસર હતા. જયારે મારો જન્મ થયો ત્યારે મિલિટરીના લોકોએ ૫૧ તોપ ચલાવી હતી.

મોન્ટુ : ઓહ ! બધી તોપ નિશાના ચૂકી ગઇ ?

☺ ☺ ☺

'યાર ! હું એક બહુ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયો છું.'

'એવું તે શું થયું ?'

'મારી પત્નીના મેક-અપનો ખર્ચ હું બરદાસ્ત નથી કરી શકતો અને મેક-અપ ન કરે તો પત્નીને બરદાસ્ત નથી કરી શકતો.'

☺ ☺ ☺

મુન્નો : અરે સર્કિટ બાજુના ઘરમાંથી ડોકટરને બોલાવી લાવ. મારી તબિયત ખરાબ થઇ ગઇ છે.

સર્કિટ : એ ભાઇ ! તું પોતે તો ડોકટર છે !

મુન્નો : બોલે તો મારી ફી બહુ વધારે છે.

☺ ☺ ☺

પ્રાણી સંગ્રહાલયમાં જય ગયો હતો ત્યાં એણે સિંહનું પાંજરું ખૂલ્લું રાખી દીધું.

ઓફિસર : તે સિંહનું પાંજરું ખૂલ્લું કેમ રાખ્યું ?

જય : સર ! મેં વિચાર્યું આવા ભયાનક હિંસક પ્રાણીને કોણ ચોરી જશે?

બોસ : તેં આ વર્ષે ખૂબ મહેનત કરી છે તેથી આ પાંચ હજારનો ચેક આપું છું.

કર્મચારી : જી સર !

બોસ : જો તું આગળ પણ આ જ રીતે કામ કરીશ તો તેના પર જલદી સહી પણ કરી આપીશ.

☺ ☺ ☺

ગોલુ : સર ! મારી પત્ની ખોવાઇ ગઇ છે.

પોસ્ટ માસ્તર : આ પોસ્ટ ઓફિસ છે. પોલીસ સ્ટેશન જઇને ફરિયાદ લખાવો.

ગોલુ : શું કરું ? આનંદના અતિરેકમાં મને કંઇ સમજાતું નથી.

☺ ☺ ☺

પિન્ટુ : ચાલ, બહાર જઇએ. તાજી હવા ખાઇને પાછા આવીશું.

મોન્ટુ : તું જા. હું પ્લેટ અને ચમચી લઇને આવું છું.

☺ ☺ ☺

ગોલુએ ભોલુની દુકાનમાંથી એક કિલો ગુલાબજાંબુ લીધા.

ગોલુ : આમાં તો માખીઓ છે.

ભોલ : ચિંતા ન કરો. અમે માખીઓનું વજન ગણતરીમાં નથી લીધું.

☺ ☺ ☺

મોન્ટુના પડોશી મૃત્યુ પામ્યા એટલે મોન્ટુ એમને ઘરે ગયો. શોક વ્યક્ત કરીને પૂછયું 'બોડી આવી ગયું ?'

એણે પૂછયું ત્યારે જ એમ્બ્યુલન્સ બોડી લઇને આવી. એટલે મોન્ટુએ કહ્યું, 'લો, યાદ કરતા હતા ત્યાં જ બોડી આવી ગયું. કેટલી લાંબી ઉંમર છે !'

☺ ☺ ☺

શિક્ષક : તેં સ્કૂલે આવવાનું કેમ છોડી દીધું ?

વિદ્યાર્થી : મારા પપ્પા કહે છે કે એક જગ્યાએ વારંવાર જવાથી આપણું માન જળવાતું નથી.

☺ ☺ ☺

'યાર મેં એક બાબતની નોંધ લીધી છે !'

'કઇ બાબતની ?'

'રેલવે ફાટક જ્યારે બંધ હોય છે. ત્યારે અચૂક ટ્રેન આવે જ છે.'

☺ ☺ ☺

મોન્ટુ ઝાડ પર ચડયો એટલે પિન્ટુએ પૂછયું, 'કેમ ઝાડ પર ગયો ?'

મોન્ટુ : સફરજન ખાવા.

પિન્ટુ : યાર ! આ તો કેરીનું ઝાડ છે.

મોન્ટુ : પણ હું સાથે સફરજન લાવ્યો છું.

☺ ☺ ☺

ડોકટર : હું તમને એવી દવા આપીશ કે તમે ફરીથી જુવાન થઇ જશો.

દર્દી : ના બેટા ! એવું ન કરીશ. મારું પેન્શન બંધ થઇ જશે.

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n34/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

બાળકોની અપેક્ષાઓ...

(૧) અમે મહાજલધિ ના જલબિન્દુઓ છીએ
(૨) ઘર અમારે માટે વાત્સલ્યધામ બનાવો.
(૩) અમને તમારા પ્રેમમાં સામેલ કરો, તમારી માન્યતાઓ અને વિચારધારાઓમાં નહીં.
(૪) અમને 'આમ ન કર', 'તેમ ન કર' એમ કહ્યા કરવાને બદલે શું કરવાનું તે બતાવો.
(૫) અમારી પાસે ઊંચી અપેક્ષાઓ રાખવાને બદલે અમને અમારી ગતિએ વિકસવાની તક આપો.
(૬) અમે જન્મથી જ અહિંસક છીએ, અમારામાં હિંસાના બીજ ન વાવો.
(૭) અમને અંતઃતૃપ્તિની પૂરતી તક આપો.
(૮) અમને સજાથી નહીં પણ સમજાવટથી શીખવો.
(૯) ભાઈ ભાંડુઓ વચ્ચે ઉછેરનો ભેદ ન રાખો અને અમારી તુલના ન કરો.
(૧૦) અમારા નાનામોટા ઝગડા અમને જાતે જ પતાવવા દો.
(૧૧) અમારાં સારા કામ અને પ્રત્યેક સફળતાની પ્રશંસા અને કદર કરો.
(૧૨) અમને ટી.વી.ની અસરથી બચાવવા હોય તો એ બદી થી તમે પણ દૂર રહો.
(૧૩) નકામા કામ માટે ટોકવાને બદલે તે કેમ સુધારવું તે બતાવો.
(૧૪) અમને આપેલાં વચનો પાળો.
(૧૫) અમને બધીજ વસ્તુઓ તુરતજ ન આપતાં થોડી ધીરજ ધરતાં પણ શીખવો.
(૧૬) અમારી સાથે ના વ્યવહારમાં દ્રઢતાં રાખો પણ ક્રૂરતાં ન રાખો.
(૧૭) અમે મદદ માંગીએ નહીં ત્યાં સુધી અમને મદદ ન કરો.
(૧૮) અમારામાં શ્રધ્ધા મૂકી અમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરો.
(૧૯) અમારી જિજ્ઞાસાવૃતિને સંતોષ મળે એવું વાતાવરણ આપો.
(૨૦) ઘરમાં અમારું સ્થાન છે એ બાબતનો સ્વીકાર કરો અને અમારી પસંદગીની પણ દરકાર કરો.
(૨૧) અમને પૈસા નહીં પણ પ્રેમ આપો.
(૨૨) અમારા મિત્રોને ઘરમાં આવકાર થાય તે જૂઓ.
(૨૩) અમને પૂરતો પૌષ્ટીક આહાર મળે અને યોગ્ય તબીબી સંભાળ મળે તેવી જોગવાઈ કરો.
(૨૪) અમને શાળા, ટ્યુશન, ઘરકામ જેવી પ્રવૃત્તિઓની સાથે સાથે રમવાનો સમય પણ આપો.
(૨૫) અમને પ્રલોભનો અને સ્પર્ધાથી દૂર રાખો.
(૨૬) અમને સ્વ બચાવ કે સ્વ રક્ષણ અંગેના પાઠ શીખવો.
(૨૭) અમને શ્રમનો મહિમા સમજાવો, શ્રમ પ્રત્યે સૂગ ઉત્પન્ન થાય એવું ન કરો.
(૨૮) અમને ઉપદેશ નહીં, ઉદાહરણ આપો.
(૨૯) અમે નિર્દોષ જન્મ્યા છીએ, નિર્દોષ જ રહેવા દો.
(૩૦) અમને કેવળ ચારિત્ર્યની કેળવણી આપો. બીજું બધું આપ મેળે શીખી લઈશું.
(૩૧) અમને સંપત્તિ નહીં, સમય આપો.

નારી...

તમારા મિત્રને આપવા જેવી ચીજ	: વિશ્વાસ
તમારા પિતાને આપવા જેવી ચીજ	: પૂજ્યભાવ
તમારી માતાને આપવા જેવી ચીજ	: રાહવર્તન
તમારા ગુરુને આપવા જેવી ચીજ	: કર્તવ્ય
તમારા દુશ્મનને આપવા જેવી ચીજ	: ક્ષમા
તમારી હરિને આપવા જેવી ચીજ	: સ્નેહશીલતા

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

With Best Compliments From

Shree Wood Pack Ply. P. Ltd.

25/2, Manjipura Ring Road, At. MANJIPURA. (Nadiad)

Mfg. of Flus Door, Block Board & Ply.

SEASONED WOOD

STRONG & DURABLE

Quality Checked OK Tested

TERMITE RESISTANT

benchmark IN QUALITY ISO. 9001

DEO
DYNAMIC EXTRA ORDINARY
PLY, BOARD & DOOR

Relic
• PLYWOOD • BLOCK BOARD • FLUSH DOOR

Soonami
PLY, BOARD & DOOR

-: CONTECT :-

Jagdishbhai	- 98244 50091	Manshukhbhai	- 98255 62847
Bhupendrbhai	- 98246 94286	Dhanjibhai	- 99250 31523

Fax : 0268 - 2550953
E-mail : swpplypltd@yahoo.in

AN ISO 9001 : 2009 CERTIFIED COMPANY

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n36/mode/1up

2014-02-15 -Patidar Bandhu (1391)

realpatidar.com

ગહન છે કર્મની ગતિ..

સંતવાણી

: સંકલન :
વિરેન્દ્ર હળપાણી

કર્મની ગતિ ઘણી ગહન છે.

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः॥

'કર્મનું તત્ત્વ પણ જાણવું જોઇએ, અકર્મનું તત્ત્વ પણ જાણવું જોઇએ અને વિકર્મનું તત્ત્વ પણ જાણવું જોઇએ. કારણ કે કર્મની ગતિ ગહન છે.' (ગીતા : ૪.૧૭)

કર્મ એવાં કરીએ કે એ દુષ્કર્મ ન બને, દૂષિત ન બને, બંધનકારી ન બને પરંતુ એવાં કર્મ કરીએ કે એ વિકર્મ બની જાય, એનો કર્તા અકર્તા બની જાય અને કર્તા પોતાનું પરમાત્મપદ પામી લે.

અમદાવાદમાં વાસણા વિસ્તાર છે. ત્યાં એક કાર્યપાલક ઇજનેર રહેતા હતા. નહેરોના પાણીની વહેંચણીનો કાર્યભાર સંભાળતા હતા. તેઓ જ આદેશ આપતા કે કયા ક્ષેત્રમાં કેટલું પાણી આપવું.

એક વખત એક ખેડૂતે એમને ૧૦૦-૧૦૦ રૂપિયાની દસ નોટો એક પરબીડિયામાં આપતાં કહ્યું : "સાહેબ! ગમે તે થાય પણ ફલાણી વ્યક્તિને પાણી ન મળવું જોઇએ. મારું આટલું કામ કરી દો."

સાહેબે વિચાર્યું 'હજાર રૂપિયા મારા ભાગ્યમાં આવનારા છે તેથી આ આપી રહ્યો છે. પરંતુ ખોટી રીતે રૂપિયા લઇને હું કર્મબંધનમાં કેમ પડું? હજાર રૂપિયા આવવાના હશે તો ગમે તે રીતે આવશે જ. હું ખોટું કામ કરીને હજાર રૂપિયા કેમ લઉં? મારાં સારાં કર્મોથી આપમેળે રૂપિયા આવશે.' એણે હજાર રૂપિયા ખેડૂતને પાછા આપી દીધા.

થોડા મહિના પછી એક વખત એ ઇજનેર મુંબઇથી અમદાવાદ આવી રહ્યા હતા. મુંબઇથી એક વેપારીનો છોકરો પણ એમની સાથે બેઠો. સુરત આવ્યું તો છોકરો ઉતાવળમાં ઊતરી ગયો અને પોતાની બેગ ગાડીમાં જ ભૂલી ગયો. ઇજનેર સમજી ગયા કે બેગ પેલા છોકરાની જ છે. અમદાવાદ રેલવે સ્ટેશને ગાડી થોભી. બેગ પડી હતી બિનવારસી... ઇજનેરે બેગ ઉઠાવી લીધી અને ઘરે જઇને ખોલી. એમાંથી સરનામું અને ટેલીફોન નંબર મળ્યાં.

અહીં સુરતમાં વેપારીનો છોકરો ઘણો પરેશાન થઇ ગયો કે : 'હીરાના વેપારીના આટલા રૂપિયા હતા... આટલા લાખનો કાચો માલ પણ હતો... કોને કહીએ? કહીશું તો પણ મુસીબત થશે.'

બીજા દિવસે સવારે એને ત્યાં ફોન આવ્યો કે : 'તમારી બેગ ટ્રેનમાં રહી ગઇ હતી એને હું લાવ્યો છું અને મારું આ સરનામું છે. તમે એને લઇ જાઓ.'

બાપ-દીકરો ગાડી લઇને વાસણા પહોંચ્યા અને સાહેબના બંગલે પહોંચીને પૂછ્યું : "સાહેબ! તમે ફોન કર્યો હતો?"

સાહેબ : "હા, તમે ધીરજ રાખો. તમારો બધો માલ સુરક્ષિણ છે."

સાહેબે બેગ આપી. વેપારીએ જોયું કે અંદર બધો માલ અને રૂપિયા સહીસલામત છે. 'આ સાહેબ નહિ, ભગવાન છે...' એમ વિચારતાં બાપ-દીકરાની આંખોમાં આંસુ આવી ગયાં, હૃદય ભરાઇ આવ્યું. એક કોરા પરબીડિયામાં થોડા રૂપિયા મૂકી સાહેબના હાથમાં આપતાં હાથ જોડીને બોલ્યા : 'સાહેબ! ફૂલ નહિ પણ ફૂલની પાંખડી. અમારી આટલી સેવા જરૂર સ્વીકાર કરો.'

સાહેબ : 'એક હજાર રૂપિયા છે ને આમાં?'

વેપારી : "સાહેબ! તમને કેવી રીતે ખબર પડી કે એક હજાર જ રૂપિયા છે?"

સાહેબ : "એક હજાર રૂપિયા મને

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n37/mode/1up

realpatidar.com

ખોટું કામ કરવા માટે મળી રહ્યા હતા. પરંતુ મેં એ ખોટું કામ એમ વિચારીને ન કર્યું કે જો હજાર રૂપિયા મારા ભાગ્યમાં હશે તો ગમે તે રીતે મળશે.'

વેપારી : 'સાહેબ! તમે બરાબર કહો છો. આમાં હજાર રૂપિયા જ છે.'

જે લોકો આડાઅવળા રસ્તેથી કંઇક લે છે તેઓ તો દુષ્કર્મ કરીને પાપ કમાઇ લે છે પરંતુ જે ધીરજ રાખે છે તેઓ ઇમાનદારીથી એમના ભાગ્યમાં હોય છે એટલું મેળવી જ લે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ''गहना कर्मणो गतिः।''

એક પ્રસિદ્ધ સાધુએ મને આ ઘટના કહી હતી : 'સ્વામીજી! અહીં ગયાજીમાં એક પ્રસિદ્ધ પંડિત રહેતા હતા. એક વખત નેપાળ નરેશ સાધારણ ગરીબ મારવાડી જેવા કપડાં પહેરી પંડિતો પાછળ ભટકયા કે : 'મારા દાદાનું પિંડદાન કરાવી દો. મારી પાસે એક પાઇ પણ નથી. હા, થોડા ચૂરમાના લાડુ લાવ્યો છું, એ જ દક્ષિણામાં આપી શકીશ.''

જે લોભી પંડિત હતા એમને તો ઇન્કાર કરી દીધો પરંતુ એ પ્રસિદ્ધ પંડિતે કહ્યું : 'ભાઇ! પૈસા નથી તો કંઇ વાંધો નહિ. હું પિંડદાન કરાવી દઉં છું.'

એ પંડિતે ફાટેલાચીંથરાં જેવા કપડાં પહેરીને આવેલા ગરીબ મારવાડીના વેશમાં છૂપાયેલા નેપાળ નરેશના દાદાનું પિંડદાન કરાવી દીધું. પિંડદાન પૂરું થયા પછી નરેશે કહ્યું :

''પંડિતજી! પિંડદાન કરાવ્યા પછી કંઇને કંઇક દક્ષિણા તો આપવી જ જોઇએ. હું થોડા લાડું લાવ્યો છું એ આ પોટલીમાં છે. મારા ગયા પછી જ અને તમે જ આ પોટલી ખોલશો એવું વચન આપો.''

પંડિતજી : ''સારું ભાઇ! તું ગરીબ છે. તારા લાડુ ખાઇ લઇશે. વચન આપું છું કે પોટલી તારા ગયા પછી જ હું જ ખોલીશ.''

નેપાળ નરેશ ચાલ્યા ગયા. પંડિતે પોટલી ખોલી તો એમાંથી એક એક કિલો સોનાના ઓગણીસ લાડુ નીકળ્યા!

એ પંડિતજી પોતાના જીવનકાળમાં મોટાં મોટાં ધર્મ કાર્યો કરતા રહ્યા પણ સોનાના લાડુ તો એમના એમ જ પડ્યા રહ્યા. કારણે કે જે સારાં કાર્યો કરે છે એને સારાં કાર્યો માટે ક્યાંક ને ક્યાંકથી ધન, વસ્તુઓ અનાયાસે મળી જ જાય છે. એમ પંડિતજીને પંણ ધન મળી જ રહેતું.

જયારે જયારે કર્મ કરીએ ત્યારે આપણે આપણાં કર્મને વિકર્મમાં બદલી દેવું જોઇએ. અર્થાત્ કર્મનું ફળ ઇશ્વરને અર્પણ કરી દેવું જોઇએ અથવા કર્મમાંથી કર્તાપણું હટાવી દઇએ તો પણ એ કર્મ વિકર્મ થઇ જશે. પછી કર્મ તો થશે પરંતુ એનું બંધન નહિ રહે.

સંસારી માણસ કર્મને બંધનરૂપ બનાવી દે છે, સાધક કર્મને વિકર્મ બનાવી દેવાનો પ્રયત્ન કરે છે પરંતુ સિદ્ધ પુરુષનાં દરકે કર્મ સ્વાભાવિક રૂપે વિકર્મ જ હોય છે. રામજી યુદ્ધ જેવું ઘોર કર્મ છે પરંતુ પોતાના તરફથી યુદ્ધ નથી કરતા, રાવણ આમંત્રિત કરે છે ત્યારે કરે છે. આથી એમનું યુદ્ધ જેવું ઘોર કર્મ પણ વિકર્મમાં પરિણત થઇ જાય છે. તમે પણ કર્મ કરો તો અકર્તા થઇને કરો, કર્તા થઇને નહિ. કર્તાભાવથી કરેલું કર્મ બંધનમાં નાખે છે અને એનું ફળ ભોગવવું જ પડે છે.

રાજસ્થાનનાં ઢોંગરા ગામ (તા. સુજાનગઢ, જિ. ચુરુ)ની ઘટના છે :

એક બકરાને જોઇ ઠકરાણીના મોંમાં પાણી આવી ગયું. પતિને કહ્યું : 'જુઓ તો! આ બકરો કેટલો હૃષ્ટપુષ્ટ છે!'

બકરો પહોંચી ગયો ઠાકોર કિશનસિં!ના ઘરે અને હલાલ થઇને એના પેટમાં પણ પહોંચી ગયો.

બાર મહિના પછી ઠાકોર-ઠાકરાણીના ઘરે છોકરાનો જન્મ થયો. છોકરાનું નામ બાલસિંહ રાખ્યું. બાલસિંહ તેર વર્ષનો થયો ત્યારે એની સગાઇ પણ થઇ ગઇ અને ચૌદમું વર્ષ પૂરું થતાં લગ્નની તૈયારી પણ થઇ.

લગ્ન વખતે બ્રાહ્મણે ગણેશપૂજન માટે એને બેસાડ્યો. પરંતુ આ શું? બ્રાહ્મણ વિધિ શરૂ કરે એ પહેલાં જ છોકરાએ પગ લાંબા કર્યા અને ચત્તોપાટ સૂઇ ગયો. બ્રાહ્મણે પૂછ્યું : ''શું થયું.. શું થયું...?''

કોઇ જવાબ નહિ. મા રોઇ, બાપ રોયો. બધા જાનૈયાઓ ભેગા થઇ

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n38/mode/1up

realpatidar.com

ગયા. પૂછવા લાગ્યા : "શું થયું?"

છોકરો : "કંઇ નથી થયું. હવે આપણી લેણદેણ પૂરી થઇ ગઇ."

પિતા : "એ કેવી રીતે દીકરા?"

છોકરો : "બકરીઓનું ગર્ભાધાન કરાવવા માટે ઉદરાસરના ચારણ કુંદરદાને જે બકરો છૂટો મૂક્યો હતો એ જ બકરો તમે ઠાકરાણીના કહેવાથી ઉઠાવી લાવ્યા હતા. એ બકરો તમારા પેટમાં પહોંચી ગયો હતો. સમય જતાં એ તમારો છોકરો થઇને જન્મ્યો. એ છોકરો લેણદેણ પૂરી કરીને હવે જઇ રહ્યો છે. રામ રામ.."

બકરાની કાયામાંથી આવેલ બાલસિંહ તો રવાના થઇ ગયો પરંતુ કિશનસિંહ માથું કૂટતા રહી ગયા...

તુલસીદીજી કહે છે : करम प्रधान बिस्व करि राखा। जो बस करइ सो तस फलु चाखा।

(શ્રીરામ ચરિતમાનસ. અયો૦:૨૧૮.૨)

(સંતશ્રી આસારામજી બાપુના સત્સંગ પ્રવચનમાંથી સંકલીત)

નરોડાના અગ્રણી દામુભાઇ ગોગારીનું દુઃખદ નિધન

નરોડા સમાજના જાણીતાં અગ્રણી મહાનુભાવ શ્રી દામુભાઇ ગોગારીનું કેન્સરની માંદગીને કારણે તા. ૯/૨/૧૪ના રોજ દુઃખદ નિધન થયેલ છે.

સ્વર્ગસ્થ દામુભાઇ ગોગારી નરોડા સમાજના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અમદાવાદ ઝોન સમાજના પ્રમુખપદે રહીને સેવા આપી ચૂકયા છે. દામુભાઇ આ ઉપરાંત નરોડામાં કચ્છ કડવા પાટીદાર ભાઇઓ દ્વારા સ્થાપવામાં આવેલ યુનિયન બેંકના ડીરેકટર પદે પણ કાર્યરત હતા. આધારશીલા શિક્ષણ સંકુલના પણ તેઓ ડીરિકટર હતા.

સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં સુવિધા યુકત છાત્રાલય બનાવવાનું તેમનું સ્વપ્ન હતું. આ માટે વર્ષ ૨૦૦૮માં કેન્દ્રીય સમાજે દામુભાઇની અધ્યક્ષતામાં બાંધકામ સમિતિ બનાવી હતી. આ હોસ્ટેલ નિર્માણ માટે દામુભાઇ તન-મન અને ધનથી સહયોગ આપવા ઉત્સુક હતા. પણ એ સમયમાં જ કેન્દ્રીય સમાજ દ્વારા શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું. દામુભાઇ સ્પષ્ટ વક્તા હતા. તેમને આ શ્વેતપત્ર વાળી વિચારધારા માન્ય ન હોતી. તેમણે કેન્દ્રીય સમાજ અને ઝોન સમાજમાંથી રાજીનામું આપી દીધું.

શ્રી દામુભાઇએ તેમના મિત્રો સાથે મળીને સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદમાં ભાડે મકાનમાં છાત્રાલય શરૂ કરવામાં આવી. જ્યારે બીજી તરફ નવરંગપુરામાં હોસ્ટેલની જમીન ઉપર હોસ્ટેલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ગત તા. ૨૬/૧/૨૦૧૪ના રોજ નવરંગપુરા અમદાવાદમાં દામુભાઇના સ્વપ્ન સમી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમ હોસ્ટેલ લઇને ઉદ્ભવેલા અનેક વિવાદો પછી પણ દામુભાઇ આર્થિક રીતે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓને ઉપયોગી એવી ભવ્ય છાત્રાલયનું નિર્માણ કરી પોતાની યાદ હંમેશા માટે છોડતા ગયા છે. દામુભાઇ સમાજસેવા માટે હંમેશા તત્પર રહ્યા હતા. તેઓ સાચા અર્થમાં કર્મયોગી હતા. તેમની ઊમદા સેવાઓની ખોટ સમાજને પડવાની છે.

પ્રભુ સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના....

બીએએમએસ થયા

કુ. ક્રિશ્ના છાભૈયા

આણંદ : અત્રેના નરોત્તમભાઇ શીવજીભાઇ છાભૈયા તથા શ્રીમતી અમિતાબેન છાભૈયાની સુપુત્રી કુ. ક્રિશ્ના છાભૈયા (મેઘપર) બી.એ.એમ.એસ.ની ડીગ્રી પ્રાપ્ત કરી સમાજ તથા પરિવારનું ગૌરવ વધારેલ છે. તે બદલ અભિનંદન..

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1391/page/n39/mode/1up

realpatidar.com

શ્રધ્ધાંજલિ

(જ.તા. ૧/૬/૧૯૫૮) (સ્વ. તા. ૮/૧/૨૦૧૪)

સ્વ. વાલજીભાઈ વિશરામભાઈ કાલરીયા

કચ્છમાં વિગોડી, હાલે - ડીસા (બ.કાં.)

કુટુંબ માટે ફુલો પાથરી ગયા, જીવન એવું જીવ્યા કે સદાય માર્ગદર્શક બન્યા,
વ્યવહાર કદી ચુક્યા નથી, કર્મ કદી ભૂલ્યા નથીં, સુખ-દુઃખમાં સદાય હસતા રહ્યા
અને સૌને હસાવતા રહ્યા, સ્નેહથી સૌના હૈયે વસતા રહ્યા, સર્વત્ર ફેલાવી સુવાસ.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આર્પે એ જ પ્રાર્થના...

લિ. **આપના આત્માની શાંતિ માટે પ્રાર્થનાર્થી સમસ્ત કાલરીયા પરિવાર**

ગં.સ્વ. જમનાબેન વિશરામભાઈ કાલરીયા (માતાશ્રી)
ગં.સ્વ. લીલાબેન વાલજીભાઈ કાલરીયા (પત્નિ)
કરસનભાઈ વિશરામભાઈ કાલરીયા (મોટાભાઈ)
ભગવતીબેન કરસનભાઈ કાલરીયા (મોટા ભાભી)
ઊર્મિલાબેન જયંતીભાઈ વાલજીભાઈ કાલરીયા (પુત્ર-પુત્રવધૂ)
લતાબેન હરેશભાઈ વાલજીભાઈ કાલરીયા (પુત્ર-પુત્રવધૂ)
વિધાબેન દિપકભાઈ વાલજીભાઈ કાલરીયા (પુત્ર-પુત્રવધૂ)
કલાબેન સુરેશભાઈ કરસનભાઈ કાલરીયા (ભત્રીજા-ભત્રીજાવધૂ)

દર્શન જયંતીભાઈ (પૌત્ર) મંત્ર હરેશભાઈ (પૌત્ર) તીર્થ સુરેશભાઈ (પૌત્ર)
કિર્તન જયંતીભાઈ (પૌત્ર) શિવ દિપકભાઈ (પૌત્ર) મન સુરેશભાઈ (પૌત્ર)

ફર્મ : **શ્રીરામ વિજય વુડન ઈન્ડ., જી.આઈ.ડી.સી., પ્લોટ નં.-૨૫, ડીસા. મો. ૯૪૨૬૩ ૦૭૫૯૯**
શ્રી રામેશ્વર સેલ્સ એજન્સી, પાટણ-પાલનપુર હાઈવે, ડીસા.
શ્રી ઊમિયા સેલ્સ, ગરનાળા પાસે, મીટર હાઉસ સામે, પાટણ. મો. ૯૪૨૮૧ ૩૬૦૦૯ (કરશનભાઈ)

realpatidar.com

https://archive.org/details/bk1391/page/n40/mode/1up



https://archive.org/details/bk1391/page/n41/mode/1up

RNI No. GUJ GUJ / 2010 / 32748
Posting Licence No. PATAN / 111 / 2010-2013
Office of Posting- PATAN H.O.
Valid up to 31-12-2013
Posting Date : 17th of every month

PATIDAR BANDHU : PATAN - Printed, Published and Owned By Brijeshkumar Chandubhai Patel and
Printed at Vinod Printery, Patan. and
Published at Patidar Bandhu, C/o. shri Ganapati Saw Mill, Verai Chakala, Patan - 384265, Gujarat.
Editor : Brijeshkumar Chandubhai Patel RNI No. GujGuj / 2010/32748

realpatidar.com